

શ્રી સુધર્માસ્વામી જ્ઞાનબંદર

Q303

300X/356

ફોન : 022-22424333

એડિટર, ગ્રાંચારક.

૧૧-૨-૨-૩૮ ૨૧ ૨૦૨-

૨૧૩

૨૭૨

દાન શ્રી ચંદ્રપ્રલસ્વામિને નમો નમ : ફુ

અનકંટકોદ્ધારક અંથમાલા-અથાંક ૧૬

# નવા વર્ગની સાધુતાનું

દિ ગુ હ શ્રી ન

~~~~~

દે... અ... ક...:-

રી... સ... ન... ક... ટ... કો... છ... ર... ક

પુ. પાડક પ્રવર શ્રી હંસસાગરજી ગણિવર્ય

\* \* \*

સુરતના સુપ્રચિદ્ધ જૈન એડવોકેટ  
શ્રીખુત અમીચંદ્ર જોવિંદજી રાહનો વિ. સં. ૧૬૮૩ને।  
પત્ર અને ખુલાસો  
તથા

પ્રાંબદ્ધાનિવાસી ભૂતકાલીન જંયુલાજી રાહ કાંગલાલ  
ભીમચંદ્રનો જંયુ વિ.ની યોગ્યતાનો પરિચય આપતો પત્ર

\* \* \*

પ્રકાશક - અને - પ્રાપ્તિસ્થાન

શ્રી શાસનકંટકોદ્ધારક જ્ઞાનમંહિર બ્યવરસાપક -  
શા. મેતીચંદ્ર દીપચંદ્ર

જી. કાવનગર, વાયા તલાજી, મુ. ઠળીયા [સૌરાષ્ટ્ર]

|              |                   |              |
|--------------|-------------------|--------------|
| વીર સં. ૨૪૬૪ | આમભોદ્ધારક સં. ૧૮ | વિ. સં. ૨૦૨૪ |
| સને ૧૬૬૭     | કિ. રૂ. ૧-૦૦      | શાકે ૧૮૮૬    |

[ પ્રથમાવૃત્તિ - કોઈ ૧૦૦૦ ]

\* પ્રા...ંક...થ...ન. \*

નવાતિથિમનને દંલત્રતિથી પકડી રાખીને પોતાના જ સમુદ્ધાયને સુવિહિત લેખાવનાર શ્રી પ્રેમસુરિજી ભ. ના શિષ્ય જંબુવિજય, કે-જેમણે સં. ૧૯૬૩થી આજુસુધી સં. ૧૯૬૨માં સ્વર્ગંહે કાઢવામાં આવેલ કપોલકટિપત તિથિમતને સાચો લેખાવવા સાર શ્રીતત્ત્વતરંગિણી જેવા પ્રોફ અને દંકશાલી અંથરતનો અનેક ચોપડીઓ, આદિ દારા લગભગ જુદી અર્થે નીપળવીને દુરૂપયોગ કરવા વડે શ્રી સંઘમાં નિરથ્યક જ અશાંતિ આથરી રાખવાનો બાબીશ અયતન વર્ણિથી જરી રાખેલ છે, તેમજ શાસ્ત્ર અને પરંપરારક્ષણો અંગે પહૃદા પાછળ રહીને બોગસ નામોવાળી અને સામાન્ય ગૃહસ્થ પણુંન લખ્યી શકે હોવાંની શકે તેવી અસર્થ-ગલીય અને ગંદી લાપાન્ન લંડાર સમી અનેક પત્રિકાઓ છપાવી પ્રયારવાનું નિંઘતર કૃત્ય કર્યાં છે, તે જંબુવિજયે, આડેક મહિના પહેલાં પોતાના શિષ્યના હાથે લખાવીને ‘શ્રી શંખેધીર પાર્થીનાથ એને વિવેકદર્શિ’ એ નામની બૂકમાં છુપાવીને ‘પ્રસ્તાવનાતિમિરતંરણિ’ એ નામની એક વધુ ગંદી બૂક શ્રીસંઘમાં પોતાના શિષ્ય નિત્યાનંદવિજયના નામે તરતી મૂડેલ ! કે-જે સર્વત્ર કીટકાર પામેલ છે.

તે બૂકના પૃ. ૪૮ થી ૪૯ ઉપર તે શિષ્યના હાથે જંબુવિજયે મારી ‘પ્રસ્તાવનાતિમિરભાર્સકર’ નામની બૂકના પૃ. ૩૨ થી ૩૩ ઉપરની સં. ૧૯૮૮માં બનેલી ભીતા બદ્લ-મને જુડો જણાવીને ‘તેવી કેદી ભીના થની જ નથી’ એમ જણાવેલ છે; જણારે સં. ૧૯૮૮માં સુરત સુકામે મારી તે લખેલ વાત મુજબ ‘થર્યી થધુ જ છે’ એમ સામિતી આપતા સજજડ પૂરાવાર્ષ-સુરતના જૈત-એડવોકેટ શાહ અમીયંદ ગોવીંદાલ બી. એ. (ઓનર્સ) એલ. એલ. બી. નો-આ પુસ્તિકામાં રજુ કરેલો તે વખતની સત્ય હકીકત જણાવતો સં. ૧૯૬૩નો પત્ર, તે બાયતમાં તે જંબુવિજયને જ સાવ જૂઠા માણસ તરીકે રૂપાંશુત ઓળખાવી આપે છે ! વાયડોએ આ બૂક મનતપૂર્વક વાચવા વિરાપિત છે.

શા. ક. ઉ. હંસસાગર ગણી.

# નવાવર્ગની સાહુતાનું દિગ્દર્શાન

....૫....૬ :-

— શા. કં. ઉપાધ્યાય શ્રી હંસાધ્રારજ ગણિ —

સુરત મુકામે પૂ. આગમોદ્ધારકશીની સમય વાત

પૂ. આ. શ્રી દાનસૂરિલુએ કખૂલીજ છે.

સં. ૨૦૨૨ના વૈશાખમાસે મેં ‘પ્રસ્તાવનાટિમિરાસકર’ નામની કે ખૂક પ્રતિષ્ઠ કરેલ, તે ખૂકના પૂ. ૪૩ ઉપર મેં નીચે પ્રમાણે લખાએ કરેલ છે.

‘પૂ. આ. શ્રી વિજયદાનસૂરિલુ મ. શ્રીના હૈયામાંતું પૂ. આગમોદ્ધારકશીના આગમશાન પ્રતિનું એથીય વધુ અહુમાન તો ‘તે સં. ૧૯૮૯ (૮૮) માં સુરત મુકામે વડાયૌટાના ઉપાશ્રયથી ગોપીપુરા નેમુલાઈની વાડીના ઉપાશ્રયે પૂ. આગમો-  
દ્ધારકશીને તે પૂ. આ. શ્રી વિજયદાનસૂરિલુ મહારાજે, (શ્રી. નેમચંદ નાથા, શા. મગનવાલ રણથોડ તથા શાહ અમીયંદ જોકિંલુ દ્વારા) ‘કહો તો પૂ. આગમોદ્ધારક ચાટ મ. શ્રીની તમામ પ્રેરપણું મારે સર્વીકાર્ય’ છે. એમ હું પોતે ત્યાંના ઉપાશ્રયની પાટેથી શ્રીસંઘ વૃદ્ધે જ્ઞાનેર કેરે અથવા આચ ફરમાવો તો જાંખું વિજયને મોકલીને તેની દ્વારા તે પ્રમાણે જાહેર કરાનું.’

એ પ્રમાણે કહેવચાવીને સુરતસંધ વચ્ચે પોતાની વધુતાનો સ્વીકાર કર્શવામાં જરાય સંકોચ રાખેલ નહિ હોવાની વાત તે તે વખતે ત્યાં હાજર હતા તે શ્રી જંબૂવિજયજી આદિ આ આધુનિક લાઇચેને અનુભવગમ્ય પણ હોવા છતાં હવે તેને યાદ કરવાની ય ચોચ્યતા ગુમાવી એઠેલ છે, ત્યાં શું ઉપાય ?  
**હવે શ્રીજંબૂવિ.કુહે છેકે 'તેવી કોઈ બીના બની જ નથી !'**

મારી ઘૂકના કહેવાતા જવાબ તરીકે નવા વરો 'નિત્યાનંદ વિ.'ના નામે ગત વર્ષના આપાદમાસે 'પ્રસ્તાવનાતિમિર-તરણી' નામની એક ઘૂક જાહેર કરેલ છે.

મારી 'પ્રસ્તાવનાતિમિરભાસ્કર' ઘૂકના પૃ. ૪૩ ઉપરના મારા ઉપર્યુક્ત લખાણુના જવાબમાં નવા વર્ગની તે ઘૂકના પૃ. ૪૮ થી ૪૯ માં તેમના ગુરુના ગુણોતું મારામાં આરોપણ કરીને નિત્યાનંદે લખ્યું છે કે-

'શ્રીમાનું હં સાગરજીને તેમના ગુરુઓ તરફથી સાચું લખવાતું શિક્ષણ મળ્યું જ ન હોય, તેમ જણ્યા છે. કારણું એદું લખવામાં તેઓ જરાય ગાંઝયા જાય તેવા નથી.  
 ( પ્રસ્તાવનાતિમિરભાસ્કરના ) પૃ. ૪૩ માં તેમણે આ. શ્રી સાગરાનંદસૂરિજીની પોટી બડાઈ હાંકવા માટે-'સ. ૧૯૮૮ (૮) માં સુરત વડાચૌટાના ઉપાશ્રેષ્ઠી પૃ. આ. શ્રી વિજયદાન-સ્વરણજી મહારાજે (શા. નેમચંદ નાથાં, શા. મહેનદ્રાત્મ રણણોડ તથા શાહ અમીચંદ ગોવિંદજી) જોયો અધ્યાત્મગુજરાતી ગ્રંથા છે. તેઓ દ્વારા-ગોપીપુરા નેમુલાઈની વારીના ઉપાશ્રેષ્ઠી

કહેવડાંયું કે—‘કહો તો તમારી [ પુ. આગમોદ્ધારક આ. મ. શ્રીની ] તમામ પ્રરૂપથુા મારે સ્વીકાર્ય છે, એમ હું ચેતે ત્યાંના ઉપાશ્રયની પાટેથી શ્રીસંઘ વર્ચે જાહેર કરું અથવા આપ ઇરમાવો તો જંખૂવિજયને મોકદીને (તેની દ્વારા) જાહેર કરાનું.’ આતો ‘સીતાલુ રાવણુનો સ્વીકાર કરવાનું કહેવડાવે’ તેના જેવી ધરાર જુડી વાત તેમણે લખી નાખી છે. સારું છે કે— માસ ગુરુ ૦૦૦૦ (જંખૂવિજય) હૃયાત છે, તેઓશ્રી તે વખતે પુ. દાનસ્કુર્ણિની સાથે જ હતા. તેમને પુછ્યાથી તે મારા ગુરુન્યે ચોકખું જણ્યાંયું છે કે—‘એવી કોઈ બીના બની જ નથી.’

**નોંધઃ**—આ લખાણમાંના છેલ્લી—‘એવી કોઈ બીના બની જ નથી !’ એ શ્રી જંખૂવિંની વાતથી, તેમણે —સંવત् ૧૯૬૬માં પ્રસિદ્ધ કરેલ ‘શ્રી કર્મગ્રહૂતિ યંથ’ની પ્રસ્તાવનામાં, ‘માર્ગખૂદ્વાર’ની પ્રસ્તાવનામાં તેમજ પંડિત ભક્તલાલ જવેરચંદે ના કહેવા છતાં પાછળથી તેમની ‘પંચ-નિર્ગંધી ગ્રહરણુ’ ખૂની પ્રસ્તાવના વગેરેમાં ‘અષ્ટમની ચર્ચા અંગેની જે જે કલ્પિત બીનાઓ લખી છે તે તે બીનાઓ તો આસનહેવના પ્રતાપે તે શ્રી જંખૂવિના હાથે જ જોટી ઠરી જણા પાયે છે ! કારણકે—શ્રી જંખૂવિના ‘તે વખતે ત્યાં એવી કોઈ બાના બની જ નથી !’ એવાક્યથીતો ને તે તે પુસ્તકેની પ્રસ્તપાત્રાણેમાં તેમણે ચીતરેલી તે સં. ૧૯૮૮માં સુરત થએલી ‘અષ્ટમ’ની ચર્ચાવાળી વાતો તો અની જ નથી !’ એમ તે શ્રી જંખૂવિને જૂનખી કરી આપ્યું છે ! અને તે સં. ૧૯૮૮માં સુરતમાં થએલી ‘અષ્ટમ’ની ચર્ચા અગે

અનેલી સત્ય વાતને ધૂપાવીને તે તે પ્રસ્તાવનાઓમાં શ્રી જંખુ વિઠોએ તે સત્ય વાતને સ્થાને સરાસર અસત્ય વાતો ઉપજની કાઢીને લખવાના કરેલા અસાધુજનોચિતહોષનું એ પ્રકારે પોતાને પોતાના હાથે જ પ્રાપ્ત થયેલ પ્રાયશ્ક્રિત છે. જ્યારે ‘પ્રસ્તાવના તિમિર ભાસ્કર’ના પૃ. ૪૩ ઉપરની મેં ભથ્થણે જણ્ણાવેલી સં. ૧૯૮૮ની તે અંગેની ચર્ચાગત બીના તો બની જ છે, એમ સજજડ આધ્યાર રજુ કરવા પૂર્વે જણ્ણાવવાનો મારો આ પ્રયાસ છે. જેથી આત્મી છે કે—આ નીચે જણ્ણાવાનું સમસ્ત લખાણ લક્ષ ફર્જને વાંચ્યા પછી મધ્યस્થ સુસ વાંચકોને એ નિર્ધાર થશે જ થશે કે—‘મારી તે પૂકુમાંની તે વાત નિત્યાનંદના લગ્ના પ્રમાણે—સીતાળ રાવણુનો સ્વીકાર કરવાનું કહેવરાવે, તેના જેવી ધરાર તો શું ? પરંતુ રંચમાત્રય જુઠી નથી, અને નલકુણેરની પલી ઉપરંભ રાવણુનો સ્વીકાર કરવાનું કહેવરાવે, તેના જેવી ધરાર સાચી છાવા ઉપરંત રાવણે સામેથી તે ઉપરંભના શીથલનું રક્ષણ કરવાની જેમ તે વખતે પૂ.આ.શ્રી દાનસુરિજીની લાજનું રક્ષણ કરવા સુધી સાચી છે!!!

નવા વર્ગની તે ‘પ્રસ્તાવના તિમિરતરણિ’ ખૂકના પૃ. ૪૮-૪૯ ઉપર—‘અષ્ટમાની સુરતની ચર્ચાને અવલંબીને—નિત્યાનંદે જે ઉપર્યુક્તારીત્યા તે બાબતમાં મને પણ પોતાના તે ગુરુ જેવો ક્ષેણીને ‘તેવી કોઈ બીના અની જ નથી’ એમ તેમના ગોળના નામે જણ્ણાવેલ છે, તે વાતનો મેં ગત વર્ષ સં. ૨૦૨૩ના આસ્તે માસના પ્રસિદ્ધ થયેલ ‘નવામતિના વિવેકદર્શનનું

પ્રદર્શન' નામની ખૂકના પેંડ ૩૨ થી ૩૩ ઉપર અર્થાપત્તિથી નીચે પ્રમાણે ખુલાસો આપેલ છે.

### નિત્યાનંદ વિઠના લખાણુનો જવાબ

'(સ. ૧૯૮૮માં) મુખ્યથી આવી રહેલ પૂ. આ. શ્રી દાનસૂરિજી મં પણ અમો સૌ સાધુના સ્વાગત સહિત શ્રી જંખુવિં આદિ પરિવાર સાથે સુરત પદ્ધારેલ, અને પૂજયશ્રીથી કરી લીધેલ વિકારોપશમનના યોંગે નેમુલાઈની વાડીના ઉપાશ્રયની પાછળાની ધર્મશાલામાં (માળ ઉપર પૂજય આગમોદ્વારકશ્રી હોવાથી) નીચે શાંતિપૂર્વક ઉત્તરેલ : છતાં પૂ. આગમોદ્વારકશ્રીને મળીને મતલેદો સમજુ દેવાનો તેઓશ્રીએ એ દિવસ સુધી કરો। જ પ્રયાસ કરોં નહિ ! આથી ત્રીજે દિવસે આ લેખકે જ નીચે તેઓશ્રીને મળી ૧૧ બજે શ્રી જંખુવિ. સહિત ઉપર લાવીને પૂ. આગમોદ્વારકશ્રીની સાથે તે તે મતલેદો ચર્ચા દેવાની ક્રેઝ પાડેલ. મુખ્યત્વે ચોમાસાની દીક્ષા અને ગર્ભાષણની દીક્ષા અંગે પૂ. આગમોદ્વારકશ્રીએ, શ્રી જંખુવિ(પૂ. દાનસૂરિજીએ તો મૌન જ પકડેલ.) ને ડોઢેક કલાક સુધી સમાધાનો આપેલ. ગોચરી બાદ બપોરે ઉપાશ્રયના હોલમાં પ્રાય : અદીથી પાંચ સુધી ચર્ચા ચાલેલ. પરિખૂમે તેઓશ્રીની માન્યતા ખોટી હોવા તે બહેર થવાનો ટાઈમ અન્યો જોઈ ને તેઓશ્રી તે જ દિવસે સાંજે છ વાચે સસમૃદ્ધાય વડાચૌટાના ઉપાશ્રયે વિહાર કરી અયેલ. બાદ ચોથા દિવસે પ્રાય : સાડા ત્રણ વાગે વડાચૌટાથી તેઓશ્રીએ, પૂ. આગમોદ્વારકશ્રીને અમીચંદ ગ્રેવિંઝનું-નેમચંદ નાથ અને

મગન રણુછોડ મળી સુરતના ત્રણ આગેવાનો સાથે ખાસ કહેવાલેલ કે—‘આપની જે જે પ્રદ્રપણુંએ છે તે અમોને માન્ય છે અને આવતી કાલે જ વ્યાખ્યાન પાટેથી હું ચોતે બાહેર કરેં એવી મારી ભાવના છે, પરંતુ આપની છચ્છા હોય તો જણ્યુ કી. વ્યાખ્યાનમાં તે પ્રમાણે બાહેર કરે.’ આ સાંલળી પ્રસન્ન થયેલ પુ. આગમોદ્વારકશ્રીએ તેઓને તરત જ જણ્ણાવી દ્વારેલ કે—‘તમ હોય જ નહિ ! તેઓની લાજ તે મારી લાજ છે ! આટલું કણૂલ કણ્ણું’ તે જ ખસ છે !’ (નુચો—આજથી ૩૦ વર્ષ પૂર્વે છપાયેલ ‘હિશા ફેરવો’ નામની ખૂકનાં પુ. ૬-૭) તે પછી વડાચૌટાથી તેઓ ચુપચાપ વિહાર કરી ગયેલાં છતાં દૂર ગયા પછી વળી પાછા પ્રાય: સર્વત્ર ‘અમારી માન્યતા સાચી છે.’ એમ ખોલવા અને પ્રચારવા લાગેલ ! આથી ‘તેઓશ્રીની આ કષ્ટ જાતની પ્રમાણિકતા ?’ એમ આશ્ર્ય થયેલ.

જીવંત શાહને ગુજરી ગાંધેલ લેખાવવાની અધ્યમતા !

ઉપર્યુક્ત જવાખવાળી મારી તે ‘વિવેકદર્શનનું ગ્રદર્શન’ નામની ખૂક ગત વર્ષે આસો માસે સુરત સુકામે પુ. આ. શ્રી કસ્તુરસ્સુરિલુ મ. પાસેથી ત્યાંના વતની અને સુરત શાહેર તથા સુરત જીલ્લા તરફથી શેડ આ. ક. ની પેટિના દીર્ઘકાલીન પ્રતિનિધિ-સુશ્રાવક શેડ અમીચંદ ગોવીંદજી શાહ બી. એ. (ઓનર્સ) એલ. એલ. બી. એડવોકેટને વાંચવા પ્રાપ્ત થયેલ. મારી

પ્રસ્તુત પુસ્તિકા નવા વગ્નિ ને પુસ્તિકાના જવાખરપે છે તે નવા વગ્નિ ‘પ્રસ્તાવના તિમિર તરણી’ ખૂક તેઓશ્રીને નવા વગ્નિ નહિં મોક્ષેલ હોવાથી તેઓશ્રીને તે ખૂક વાંચવા નહિં મળેલ; પરંતુ તે વગ્નિ પોતાની તે ખૂક સુરતમાંના પોતાના રહયા ખડયા અનુરાગીએ પર મોક્ષેલ, તેનાથી સહરહૂ શોઠ અમીચંદ ગોવિંદજી શાહ એડવોકેટના જાણવામાં આંધું કે-નવા વગ્નિ તે ખૂકમાં—‘હું લુચંત હોવા છિતાં ગુજરી ગયો હોવાનું લખ્યું છે !’ આથી આશ્ર્યચક્ષિત થએલ તેઓશ્રીએ ધાર્યું કે—‘અતે સં. ૧૯૮૮માં અમો આદિ ત્રણ આગેવાન જૈન સદ્ગૃહસ્થોની રૂબરૂ બનેવી અને સં. ૧૯૯૨માં ‘દિશા ફેરવો’ નામની ખૂકમાં મુનિશ્રી હંસસાગરલુએ અક્ષરશઃ જષ્ણાવેલી ‘આધ્યમ’ શાખના અર્થનિર્ણય અંગેની અયેતિ હુકીકતનો ઈન્કાર કરવા અને અને તે હુકીકતના તે દેખક મુનિશ્રીનું લખાલુ કલ્પિત દેખાવવા સારુ તે વગ્નિ, મારા માટે આ -હું લુચંતને પણ મરી ગયેલ દેખાવવાને ગોળો જણાવેલ લાગે છે ! પરિણામે શાસનની દાંજ ધરાવીને સત્ય હુકીકતના રક્ષણ અથે તે શ્રીશાહે, સં. ૧૯૮૮ના તે ચર્ચાના પ્રસંગજન્ય હુકીકતને તેમજ તે હુકીકતનો-તે ત્રણેય આગેવાન જૈન સદ્ગૃહસ્થોના હાથે-ઈન્કાર પ્રસિદ્ધ કરાવવાના નવા વગ્નિ વિદો સુધી કરેલા નિર્ધલ પ્રયાસને સર્કાર્સાપણે જષ્ણાવતો મુદ્રિત એરેસવાળો પત્ર, ( પુ. આગમોદ્વારક આ. મ. શ્રી .ઉપર સં. ૧૯૯૩માં લખેલ મુદ્રિત એરેસવાળા પત્રની નકલ

સાથે ) લખી મોકલેલ છે, તે પત્ર વગેરેને કલ્યાણુકામી જૈનોની જાણ માટે આ નીચે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

### શેડ આ. કે. ની પેઢીના નામાંકિત ગ્રાચીન પ્રતિનિધિ

### શેડ અમીચંદ ગોવીંદજી શાહના સત્યગ્રિય પત્ર

અમીચંદ ગોવીંદજી શાહ

નવાપુરા કરવારેડ

બી. એ. (ઓનર્સ) એલ. એલ. બી.

સુરત

એડવેક્ટ

સં. ૨૦૨૩, આસો  
વદ્દ ઊ, શનિવાર,

તા. ૨૧-૧૦-૧૬૬૭

પરમ પૂજય મહારાજશ્રી શા. ક. ઉદ્ધારક ઉપાધ્યાયજી  
શ્રી હંસસાગરજી ગણ્યિવરની પવિત્ર સેવામાં, લી. સુરતથી  
પાદરેખું અમીચંદ ગોવીંદજી શાહના સપ્રેમ વંદના.

ધણું લાંખા વખત સુધી આપણે સહકારથી શાસનસેવા  
કાર્યમાં સાથે હતા. એટંથે ઓળખાણ-પરિયની જરૂર નથી,  
પરંતુ પત્ર લખવાની પ્રેરણા, આપના ‘વિવેકદર્શનનું પ્રદર્શન’  
નામનું પુસ્તક અત્રે ભિરાજમાન આચાર્ય વિજય કસ્તુરસૂરિજી  
પાસે લઈ વાંચ્યું તેથી મલી છે.

જે પુસ્તકના જવાખડપે આપે ઉપરનું પુસ્તક ખડીએ  
પાડયું તે પુસ્તક તપાસ કરતાં પણ મારા જેવામાં આવ્યું  
નથી. પરંતુ અત્રેના સુશ્રાવક વૈધરાજ ખાખુલાઈ જેવા પાસેથી  
જાણવા મળ્યું છે કે તે પુસ્તકમાં મને સ્વર્ગવાસમાં પહોંચેલા

જલ્લાભ્યું છે અને (તે) કંઈક બહનક્ષી પણ કરી છે. બહનક્ષીની પરવા નથી અને મને સ્વર્ગમાં મોકલ્યો તેની ચિંતા નથી, કારણકે-હું અતે જીવતો જાગતો તંહુરસ્ત એડો છું. જે કે થાડા વખતમાં જપમાં પ્રવેશ કરીશ એટંકે શરીરમાં વૃદ્ધાવસ્થાની કુદરતી નબળાઈ તો રહેવાની જ. અને સંવત ૧૯૮૮માં સુરત ગોપીપુરા વડાચૌટામાં પ. પૂ. સાગરજી તથા પ. પૂ. દાનસૂરી વચ્ચે થાંદી ચર્ચાને અમે તેમ ચીતરવાથી કેાછ પ્રતિકાર કરનાર જીવતો નથી એમ માનીને તેવું લખાય થયું હોય તો જાનો જાણો.

આપના ખાસ ધ્યાન પર એ લાવવાનું કે-આપના 'દિશા ફેરવો'ના સંવત ૧૯૮૮ના પ્રકાશન પછી વર્ષો સુધી સંવત ૧૯૮૮ની ચર્ચાને ધનકાર હમારા કેાછ પાસેથી નહિ કરાવી શકેનાર આટલા વર્ષો કેમ ખાડાર આવે છે ? નેમચંદ નાથાલાઈ ચર્ચા ખાદ આશરે પાંચેક વર્ષ જીવ્યા હુશે અને મગનલાવ રખુછોડ તો આશરે ૨૫ વર્ષ જીવ્યા હુશે, થાડા વર્ષો ઉપર અતે ગુજરી ગયા છે અને હું હજુ એડો છું.

જે જરૂર હોય તો, ખરી હડીકરોવાળું સ્ટેટમેન્ટ આપ મોકલ્યો તો હું સહી કરીઃ જરૂર હોય તો મેળુસ્ટ્રેટના સહી સીકુઅથી મોકલી આપીશ. શાસનસેવાનું ઝર્ય થતું હોય તો જરૂર લાભ આપશોલુ.

વિશેષ નહિ વખતાં મેં પૂ. સાગરજી ઉપર તા.  
૯-૧-૧૯૩૮ ને રોજ વખેલા પત્રની એક ખરી નકલ મોકલી

આપું છું, તેમાંથી હું માતું છું કે-આપશ્રીને કાંઈક ઉપયોગી ભાષી મળી શકશે. મારો અસત્ત પત્ર ૪૩૨ પુ. સાગરજી મહારાજના સંબંધમાંથી મળી રહેશે.

આપશ્રીને વિનિતિ કે-આ પત્ર મળેથી તુરત તેની પહેંચય લખી મોકલશો. કારણુકે-આ જમાનામાં પત્ર પહેંચે એ કાંઈ નિશ્ચિત હોતું નથી. આ સાથે આશરે ૩૦ વર્ષ ઉપરના મારો પુ. સાગરજી ઉપર લખેલા પત્રની નકલ થીડી છે.

દ: અમીયં દ શાહના ઘણુા ઘણુા વંદના સ્વીકારવા કૃપા કરશોજી. કામકાજ ફરમાવશોજી.

**નોંધા:**- ‘પુ. આ. શ્રી દાનસૂરિજી મ.શ્રીથી સક્રિયાસ-પારદ્યાયાના ‘અડ’ માં-પૂજ્ય આગમોદ્વારક આ. મ. શ્રીએ સં. ૧૯૮૭ના ચોમાસામાં આપેલ અને ૧૯૮૮માં સવા છ વર્ષની આપેલ દીક્ષા અંગે-‘એ રીતે દીક્ષા તો એ આપે, હું ન આપુ’ એમ પુ. આગમોદ્વારક આ. મ. શ્રીના તે તે શાખાધારીય દીક્ષાપ્રદાન વિષે વિરુદ્ધ આવાએલ, તે બદલ-ઉક્તા પુ. ખજે આયાર્થીના સં. ૧૯૮૮માં સુરત મુકામે થએલ સુખગ મીલન પ્રસંગે તેઓશ્રી વચ્ચે-ચર્ચાથતાં પુ.આ. શ્રી દાનસૂરિજીએ પોતાની તે ભૂલને સરલતાથી સ્વીકારીને સુરતના ત્રણ આગેવાન કૈન સહગૃહસ્થી મારશ્તા ‘પુ. સાગરજી મ. શ્રીની બધી જ પ્રરૂપણાચો મારે માન્ય છે., એમ ત્યાંની પાટેથી સંઘ વચ્ચે જાહેર કરવાનું પણ કહેવડાવેલ.’ એ વગેરે અનેલી હક્કીકત, મેં મારી.સં. ૧૯૯૨ની ‘દિશા ફેરવો’ ખૂબું

પ્રસિદ્ધ કરવાથી જૈન જગતભરમાં બાહેર થઈ જવા પામેલ. આથી સં. ૧૯૮૮ની ચર્ચાના તે અંભલ બાદ સુરતથી વિહાર કર્યા પછી પૂ. દાનસૂરિજી મહારાજે પોતાનાથી તે તે દીક્ષા વિરુદ્ધ પ્રથમ બોલાઈ જવા પામેલી વાતને તે અંભલ મુજબ સુધારીને પ્રચારવામાં હાનિ દેખીને સર્વત્ર પ્રથમ બોલાએલ વાતને જ સાચી લેખાવવા માંડેલ ! આથી તે ચર્ચાના પરિચિત સૌ કોઈ તેઓશ્રી પ્રતિ શાંકા ધરવા માંડેલ. ક્રમે કરીને તે શાંકાશીલતા સર્વત્ર પ્રસરી. તેને દૂર કરવા માટે તે આ. શ્રી દાન-પ્રેમ-રામ-જંપવાદિશ્રીજીએ, ઉપર મુજબ મારી તે 'દિલ્યા ફેરવો' બૂકમાંના તે અણ્ટમની ચર્ચાવાળા સત્ય લખાલુનો તે ચર્ચામાં જેઓ હતા તે પણ જૈન આગે-વાનો મારણેત જ ઈન્કાર કરાવવાનો કૂટપ્રયાસ વર્ષો સુધી પણ કરી છૂટેલ ! પરંતુ શાસનહેવની કૃપાથી મારી તે સત્ય હકીકતને શાસનમાંથી ઉડાવી દેવાનો તેઓનો તે સામુહિક ખાનગી પ્રયાસ નાખેલ નીવડ્યો અને તે પ્રયાસ પણ બાહેરમાં આવી જવાના પ્રતાપે માર્યો તે પ્રસિદ્ધ વાતનો તેઓ સં. ૨૦૨૨ સુધીના ૩૦ વર્ષ સુધી તો બતે પણ ઈન્કાર કરવાના હોથાંઝોશ જ ગુમાવી દેવાની કાહિશિક સ્થિતિને ભરવા પામેલ ! એ નાખામાં રહેલ.

આ પ્રકારે સાચી થીનાઓને, તેઓ યેનકેનાંિ ઘેણી લેખાવવા જ પ્રયત્નશીલ રહેતા હોવાનો આ મજાગૂત હાયકો છે. પોતાની અસત્ય પ્રરૂપણાઓને નેઓએ ત્યારથી માંડીને ક્રમે બેસ્થા પણ એ પ્રકારે જ શ્રીઅંધમાં સાચી લેખાવવા પ્રયત્ન

જારી રહેલ ! જે તેના જૈન પ્રવચન-વીરશાસન-વિવિધ પ્રક્ષોત્તર ભાગ બીજના પૃ. ૧૧૧ થી ૧૧૮ તથા પૃ. ૨૬૪ થી ૩૦૧ સુધીમાં તેમ જ કુર્મપયડી-માર્ગણુદ્વાર વગેરેની પ્રસ્તાવનાદિમાં સુરતના તે અંનામ કરતાં વિપરીત- રીતે ચીતરાચેલું મોળુદ છે. બહુ શિષ્ય સંખ્યાંક પીંછના માયા મયૂરતું આજે પણ તેમના તેવા કેટલાક સુવિહિત પીંછાચોથી પ્રભુ-શાસનમાં એ પ્રકારે જ નૃત્ય ચાલી રહેલ હોયને શ્રીસંઘાચે તેઓના પ્રચારથી ઝૂબ જ ચેનીને 'ચાલના જેદું છે.

**અવતરણુ:-** સં. ૧૬૮૮થી પૂ. આ. શ્રી દાનસૂરિલુચે તો ઉપર્યુક્ત રીતે નિજની કખુદાતથી ઇરી જરૂરને પોતાના તે તે પેપરો અને પુસ્તકોની પ્રસ્તાવનાઓ વગેરેમાં પોતાની મૂડું અસત્ય તરીકે સાબિત થાયેલી માન્યતાને જ સત્યમાન્યતારૂપે લખવું લખાવવું અને પ્રચારવું શરૂ કર્યું; પરંતુ તેઓશ્રી સં. ૧૬૯૨ના મહામાસે કાલધર્મ પામ્યા બાદ તેઓશ્રીના પ્રશિષ્ય જંયૂ વિ. એ તો 'કુર્મપ્રકૃતિ' વગેરેની પ્રસ્તાવનામાં સુરત મુકામે થયેલ તે શાસન માન્ય અંનામવાળી ચર્ચાનુસાર 'તે પ્રસંગે અમોચે સત્યાર્થનો સ્વીકાર કરવારૂપ પીછેછું કરી હતી' એમ સાચું લખવાને બદલે-'સં. ૧૬૮૮માં સુરતમાં અધ્યમ વાહીને શાસ્ત્રોના વિરોધ ખતાવી મૌન પકડાવેલ' વગેરે સદંતર જુદું લખાયું ચીતરીને પોતાના તે પરાલનને પોતાની જીતનું રૂપ આપવા વડે મહામાયામુપાવાદનું 'સેવન ઊર્ધ્વામાં પણ સંકોચ અનુભવેલ નથી ! તેવા એ આમૂલયૂલ જુઠા સાધ્વાક્ષાસે સં. ૧૬૯૩માં પ્રચિદ્ધ કરેલ તો 'કુર્મપ્રકૃત'

અન્યની પ્રસ્તાવનામાંનું તેવું જુહું લખાણું, (સુરતમાં થએલ તે ચર્ચાના ઉપર્યુક્ત સદ્ગ્રાહના સાધાંત અનુભવી) સુશ્રાવક શોઠ અમીચંદ ગોવીંદજી શાહના વાંચવામાં આવતાં તેઓને [પિતાને સાહુ ગણ્યાવતા એ માણસે સત્ય વાતને છુપાવીને તેનાં સ્થાને તેવી જુઠી જ વાત ઉપભાવીને ગોઠવી દીધેલી જોઈને] આશ્ર્ય થવા સાથે અધ્યાંત ઘેદ થયો અને એ સાથે 'તે ખોટી બીનાથી શવિધ્યની જૌનપ્રણ, અવળે માગો' દોરાઈ જવા ન પામે' એ સદ્ગ્રાહના શાશ્વતથી તેઓએ,-સુરતની તે ચર્ચા પ્રસંગે જાતે અનુભવેલી હકીકતને તરત જ સંશોધથી પત્રમાં લખીને તે પત્ર, (મનોભિષ રીતે પ્રસિદ્ધ કરવાનું જણ્યાવવા પૂર્વક) પુ આગમોદ્વારક આ. દેવશ્રી ઉપર મોકલી આપેલ. બાદ આજે ત્રીશેક વર્ષે તે પત્રની એક નકલ 'ક્રિકેક દર્શાનતું પ્રદર્શન' નામની ખૂક વાંચ્યા બાદ મને પણ મોકલી આપી । જે આ નીચે અક્ષરશઃ પ્રસિદ્ધ કરવામાં આવે છે.

### પુ. આ. મ. શ્રીને શ્રીયુત શાહે પાઠવેલ પત્ર

અમીચંદ ગોવીંદજી શાહ.

નવાપુરા કરવા રેડ,

બી. એ. : ઓનસ્સ : , એલ. એલ. બી.

સુરત.

એડવોકેટ.

પોષ સુદી ૮ નેવાર રવેદ,

તા. ૬-૩-૧૯૩૮.

પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂર્યિની પત્રિન સેવામાં-

વિશેષ વિનંતિ કે શ્રી મુક્તાબાઈ જાનમંદિર ડોરાઈ તરફથી 'કર્મપ્રકૃતિ' નામનું એક પુસ્તક પ્રગત થયું છે. જેના

ઉપર કસ્કડ થયાતું વર્ષ સંવત ૧૯૬૬૩ લખેલું છે. સદરહુ પુસ્તક મારા જોવામાં આવતાં તેની અંદરની પ્રસ્તાવના વાંચતાં પાના ૭, ૧ ઉપર સંવત ૧૯૮૮ની સાતમાં સુરતમાં અષ્ટમ પ્રકરણું અંગે થયેલી વાટાધાટ વિષે પણ કાંઈક લખ્યું છે. આ વાટાધાટમાં હું પણ હાજર હોવાથી પ્રસ્તાવનાના મજબુતુર લખાણુથી મને આશ્ર્ય સાથે ઘણો ખેદ થયો છે. કારણું કે તે-લખાણું બનેલી હકીકતોથી તૃણ જીડું અને વિરસ્ક્ષ છે. પરંતુ આવી સાધુ મહારાજે વર્ચ્યેનાં ચર્ચાઓમાં શ્રાવકોએ ભાગ દેવો વ્યાજબી નહીં હોવાથી આપશ્રીના ધ્યાનમાં એ હકીકત લાવવાની મને જરૂર જણાય છે, કે જેથી આપશ્રીને ચોંચ લાગે તો જોઈતો ખુલાસો ‘શ્રીસિદ્ધચક’ દ્વારા અથવા બીજુ રીતે થઈ શકે. કારણું કે-પુસ્તકના રૂપમાં પ્રગટ થયેલી ખોટી ખીનાનો પ્રતિકાર લવિષના પ્રજા અવળે માર્ગે નહીં હોરવાઈ જાય તે માટે થવો જોઈએ એવી મારી આપશ્રીને અરજ છે.

‘કર્મપ્રકૃતિ’ની ઉપર દર્શાવેલી પ્રસ્તાવનામાં એવું લખવામાં આવ્યું છે કે—‘સંવત ૧૯૮૮ માં સુરતમાં અષ્ટમવાહીને શાસ્ત્રોના વિરોધી ભતાવી મૌન પકડાવવું’ વિગેર. હું બહુ મેટી ગંભીર જુલ કરતો નહીં હોઇ તો, હકીકત એવી બનેલી કે,- : અને આપશ્રી તથા બીજા મુનિમદારાજે તથા અમૃત શ્રાવકો પણ આ હકીકતથી સારી રીતે વાકેઝગાર હોવાથી મારી હકીકતની ખરી થવા વિનંતિ છે : . - પૂ. વિજયદાનસૂરીનું મુખ્યમની આવતા

અને આપશ્રી મુખ્ય તરફથી પધારતાં સુરત ગોપીપુરામાં નેમુલાઇની વાડીને ઉપાશ્રેયે બન્નેય સાથે રહેલા. તે વખતે અગાઉથી અધ્યાત્મની ચર્ચા ચાલુ હતી અને ભવિષ્યની સુક્ષેપ્તશાંતિ જાળવવાની તથા શાસનપક્ષનું ખળ એકત્રિત રાખવાની જરૂર હોવાથી, અધ્યાત્મની ચર્ચાનો નિકાલ કરવાનું નક્કી થવાથી, છેચેટે પૂજ્ય વિજ્યદાનસૂરિલુએ ચોકખું જણ્ણાચેલું કે-મારે અને સાગરજી વચ્ચે કંઈપણ મતલેદ રહ્યો નથી અને જાગરજીના મંત્રનું વરસ્ફ્રુદ્ધ હમેં કંઈપણ કહીશું નહીં. પૂ વિજ્યદાનસૂરિનુએ પોતાની સરળતાથી એસે મુખી કહેલું કે-જરૂર જણ્ણાતી હોય તો વ્યાખ્યાનપીડ પરથી મારા કોઈ શિષ્ય પાસે એલું જાહેર કરાલું, પરંતુ મારી યાદ મુજબ, આપશ્રીએ તેવી રીતે જાહેરાત કરાવવા ચોકખી ના પાડેલી.

ત્યારખાદ પૂ. વિજ્યદાનસૂરિલુ વડાચૌટાના ઉપાશ્રેયે પધારેલા અને ત્યાં પણ હું તથા ખીજ અમૃક શ્રાવકો વંદન કરવા ગયેલા ત્યારે અધ્યાત્મ બાબતની વાત ઝરીથી નીકળતાં, ઘણું કરીને મેંજ પ્રશ્ન કરેલો કે-'સાહેબજી, કોઈ વ્યક્તિ વ્યાખ્યાન દરમ્યાન આપશ્રીને પૂછે કે બેમાંથી કયો મત ખરો? તો આપશ્રી કેવી રીતે ખુલાસો કરશો?' ત્યારે પૂ. વિજ્યદાનસૂરિલુએ કહેલું કે પૂછનારને કહીશ કે-'તમારી પાસે કોઈ સવા છ વર્ષનો છોકરો હોય તો તેને લઈને આવો એસે હું તમોને જવાબ આપીશ.' આવા જુસસાદાર ચોકખા

શાખદો હજુપણું યાદમાં રમી રહ્યા છે.

ઉપરની હક્કીકતો ઉપર ધ્યાન આપી આપશ્રીને યોગ્ય લાગે તે મુજબ થવા વિનંતિ છે. મજફુર પ્રસ્તાવનામાં સંવત્સરી બાબત તથા મુનિસિનેલન બાબત પણ લખવામાં આંયું છે, જેના ઉપર પણ આપશ્રીનું લક્ષ્ય એંચું છું. એ બાબતો વિષે મને કાંઈ વિશેષ રીતે અંગત માહિતી નથી.

અતે ગામજાત્રા ચાલુ છે. ગાંધીકાલે પાલ ગામે જાત્રા કરી આળ્યા છીએ અને પરમ દિવસે દશમને દિવસે ઓલપાડ જવાનું નાઝી થયું છે. અત્યાર સુધીમાંડે શહેરમાં તથા વરીઆવ લાઈન્સ ક્રાન્ટારગામ વિગેરે જાત્રાએ થઈ છે. બનતા સુધી પરમા દેવસે દશમે છેલ્દી જાત્રા છે. અતે સર્વે મુનિ મહારાજાએ સુખશાતામાં છે. આપશ્રી તથા ખીજ સાંહુ મહારાજાએના સુખશાતા જણાવશોાળ. મારા લાયક આજાએ ફરમાવી ઉપકૃત કરશોાળ. આ પત્ર મહિયાનો પ્રત્યુત્તર અપાવવા વિનંતિ છે.

દી.

પાદરેણુ

અમીચંદ ગોવીંદજી શાહના

૧૦૦૮ વાર વંદના સ્વીકારવા કૃપા કરશોાળ.

નોંધ :- (૧) પુ. આ. શ્રી દાનસૂરિજી ભ. ને આ પ્રકારના કાવાહાવાથી વડિલ કરતાંય વડિલ લેખાવાનું મન તો પોતે સં. ૧૬૪૬ના માગશર શુદ્ધ પાંચમે પહેલી દીક્ષા પુ. મુનિશ્રી હર્ષવિ. ના. નામે લઈ ચંદ્રવિજયાળ બન્યા અને

તે પછી તે દીક્ષા થોડાક માસમાં છોડીને તથા તે પછી પ્રાયঃ એક વર્ષથી વધુ ગીંઝાડામાં પોલીસપટલાઈ કરીને-કરી ગોધામુકામે પૂ. મુનિશ્રી વીરવિ. મ. ના નામે પ્રાયঃ સં. ૧૯૪૭માં દીક્ષા લઈ દાનવિજય બન્યા ત્યારથી જ હતું : આ વાતની ‘પોતાના ફોટોમાં તેઓશ્રીએ, પોતાની પહેલી દીક્ષાનો જ સં. ૧૯૪૬ અને મિતિ માગ. શુ. ૫ લખવાનું રાખેલ છે’ એ નક્કર સાબિતિ છે.

(૨)-સં. ૧૯૬૧માં પોતાના સમુદ્દરાયમાં પોતે પ્રથમ જોગી તથા ‘પંન્યાસ એટબે પુણ્યનાશ’ એમ કહેતા રહીને પણ પ્રથમ પંન્યાસ બની જવામાં અને સં. ૧૯૬૮નું વડોદરા સંમેવન તોડવામાં પણ કાવાઢાના જ હતા, તે વાત તો તે પ્રસંગના અનુભવી સર્વ કોઈ મુમુક્ષુએને વિદ્ધિ છે. સં. ૧૯૮૧માં પૂ. આ. શ્રી વિજયકમલસૂરિલુએ ‘પદૃધર’ કર્યા સિવાય શિરનેરીથી બીનહકે જ પોતાને પોતાના પેપરમાં તેઓશ્રીના અનન્ય પદૃધર પણ લેખાવવા માંડ્યા હતા ! તે કાવાઢાવાની બાંળ નક્કર સાબિતિ છે.

(૩-૪)-પોતાનો શ્રીજિનાગમોમાં ઉંડો ચંચુપ્રવેશ નહોતો, એમ પોતે જાલુતા હતાઃ છતાં પૂ. આગમોઢારક આ. મ. શ્રી કરતાંય પોતાને મહાશાની લેખાવવા માટે ‘સત્યનું સમર્થન’ બૂકની-સં. ૧૯૭૬ થી વીરશાસનમાં શરૂ કરેલી જાહેરાતમાં સં. ૧૯૮૧ના એ વર્ષ સુધ્ધાં જે તે ફેરફાર કરતા રહીને છેવટે ૧૯૮૧ના વૈશાખ માસની જાહેરાતતરાગાં ચોકડામાં પોતે પોતાને ‘શ્રી જૌન આગમના પારદ્રષ્ટાં નિશેષખણી ઓંગારાવી દીધા !

એ કાવાદાવાની ત્રીજી અને પૂ. આ. શ્રી હરિલલદસુરિજી મ. કરતાંય પોતાને મહાન જ્ઞાની લેખાવવા સારુ જ જાણે હોય તેમ સં. ૧૯૮૮ના ‘વિવિધ-પ્રક્ષોત્તર’ના મુખ્યપૃષ્ઠ ઉપર પોતે ‘સક્લાગમરહસ્યવેદી’ વિશેષજ્ઞાની અનિચ્છા બતાવતા રહીને પોતાને ‘સક્લશાસ્ક્રપારદ્ધિયા’ તરીકે પણ ઓળખાવી દીધા ! તે માનદશાસ્ક્રૂચક કાવાદાવાની ચોથી નક્કર સાભિતિ છે.

(૫)-સં. ૧૯૭૮ના વીરશાસન માસિક વર્ષ ૨ અંક ૪ના પૂ. ૧૬૩ ઉપર છપાવેલ પોતાના ૩૪ મા પ્રક્ષોત્તરમાં ‘સૂતકવાળા ઘરોમાં સાહુઓચે ગોચરી ન જવાય’ એ વાત જણાવવી રહી ગયેલ, તે વાત-સં. ૧૯૮૮ ના ‘વિવિધપ્રક્ષોત્તર’ લા. ૧ના પૂ. ૧૬ ઉપર સુધારીને છપાવેલ તે ૩૪મા પ્રક્ષોત્તરમાં વધારી હેવા વડે ‘સૂતકીને ત્યાં ગોચરી ન જવાય’ એમ જ પે.તાની માન્યતા હોવાનું જણાયા બાદ (અને આ લેખકે તો તેઓશ્રીની તે માન્યતા સં. ૧૯૮૮ સુધી તો જાતે અનુભવેલ હોવાથી તેઓશ્રીની તે ચાલુ માન્યતામાં પણ) પૂ. આ. શ્રી વલ્લભસુરિજીએ ‘પ્રેમચર્ચરી’ નામના શ્રીંથના આધારે પ્રસિદ્ધ કરેલ નિષિદ્ધવાતોને ઓટી લેખાવવા સારુ તે ‘સક્લશાસ્ક્રપારદ્ધિયા’ના ‘અહુ’ને તથા પરતેજ અસહિષ્ણુતાના ગુણુને વશનતી બની-તે જ ‘વિવિધપ્રક્ષોત્તર’ અન્થના પૂ. ૨૧૦ થી ૨૧૪ સુધીમાં શાસ્ક તથા પ્રક્ષોત્તર અન્થોના અસદુ અર્થો ઉપલબ્ધ પૂર્વક નિર્ધાર્થક જ હોળા કરેલા ૨૩૦મા પ્રક્ષોત્તરમાં-‘અદી માટે મહાન જમીનદોસ્ત કર્શવાની જેમ-’ શ્રીસંઘમાંથી સૂતકનું ‘પાલન જ ઉડાવી હેવાના

ભરેત્ત પાપ પગડાનું મૂળ પણ તે પ્રકારના માનદશા સ્ફૂર્યક  
કાવાદાવા જ હતા.

(૬)-સં. ૧૯૮૫માં શ્રીસંધને કરી જ ઉપયોગી નહિએ  
અને કલેશદાયી ધારી એવી ‘પદૃધર’ અંગેની સ્વમાન  
ખાતર જ ચર્ચા ઊભી કરીને શ્રીસંધમાં કલેશના નિરર્થક જ  
બી વાન્યાં ! તે પણ કાવાદાવા મૂલક જ હતા.

(૭)-સં. ૧૯૮૭માં એ જ અહુંભાવમાં પ્રસ્તુત ‘દીક્ષાએ  
એ આપે, હું ન આપુ’ એમ કહેવા અને પ્રચારવા મંડી  
પડીને પૂ. આગમોદ્વારક આ. મ. આની તે સૌદ્ધાંતિક વાતને  
અસૌદ્ધાંતિક અને પોતાની અસૌદ્ધાંતિક વાતને સૈદ્ધાંતિક  
હેખાવવાનું આહેલ તાંડવ પણ પોતાને જિન ગમપારદશ્યા  
હેખાવવાના કાવાદાવા મૂલક જ હતું. પરિણામે ધર્મીજનોમાંના  
પણ કેટલાક કલ્યાણકાની જનોને ખાતરા અને કેટલાકને  
શાસન સંરક્ષકો સામે બાંગરા ખનાવવાનું પાપોપાર્નન કરેલ,  
તે નકામાં.

(૮)-અને તેના પણ પરિણામે-સં. ૧૯૮૯માં સુરત  
મુકામે આવીને તે વિષયની ચર્ચામાં અનિષ્ટાએ પણ જંપલાવનું  
જ પડ્યું. અને તેના પણ પરિણામે શ્રીયુત ઓડિયોકેટ શાહે  
ઉધર જણાવેલ છે તે મુજબ ત્યાં થએલ ચર્ચામાં નરવશ થઈને  
તેએશ્રીએ પોતાની તે ભૂત સ્વીકારવી જ પડેલ ! પાછળથી  
તો તે સ્વીકારમાંથી પણ કરી ગયા ! એટલે તે બનેલ સારી  
વાતનો છેવટ આવકોના હાથેય ધન્કાર બહેર કરાવવાના

કાવાદાવા કરી છૂટયા ! તેઓશ્રીએ ‘આણુએ ધર્મો’ એમ વારંવાર પણ કહેતા રહેવા પૂર્વક પોતાની ખૂબજ લેરશોરથી ભતાવાતી હતી તે શ્રી જિનેશ્વર ભગવંતના શાંતોની વક્ષાદારી મૂલમાં આવી હતી ! આથી પણ તેઓશ્રીને પૂ. આગમોદ્વારક આ. મ. શ્રીએ શ્રીસિદ્ધચક્રપાક્ષિકમાં એકવાર ‘સર્કલાગમ રહસ્ય (નવકાર) વેદી’ તરીકે એળખાવેલ છે.

સવા છ વર્ષે દીક્ષા આપવાની તેમની પણ તૈયારી !

સં. ૧૯૮૮માં સુરત મુકામે થએલ ચર્ચાગત ‘અધ્યમ’ શરીફનો અર્થ, પૂ. આ. શ્રી દાનસૂરિલુએ એ પ્રમાણે પૂ. આગમોદ્વારક આ. મ. શ્રી એ સમજાયા પ્રમાણે કષ્યૂલ કરવા ઉપરાંત પૂજયશ્રીની બધી જ પ્રરૂપણાઓને સાચી તરીકે સુરત નેમુલાઈની વાડીના ઉપાશ્રયની પાટેથી શ્રીસંધ વચ્ચે પોતે જાહેર કરવાનું પણ જણાયું હતું, અરે ! તે પછી તો વડાચૌટાના ઉપાશ્રે—‘આડમુ’ અને ‘આડ’ એ બે મતમાંથી કયો મત સાચો ? એમ પૂછનારને આપશ્રી શું ખુલાસો કરશો ?’ એમ પૂછનાર એ જ શ્રીયુત એડવોકેટ શાહને તેઓશ્રીએ આપેલા—‘તમારી પાસે કોઈ સવા છ વર્ષને છોકરો હોય તો તેને લઈને આવો એટલું હું તમને જવાબ આપીશ.’ એવા જુસસાદાર ઉત્તરમાં તેઓશ્રી પણ સવા છ વર્ષની ઉમરનાને દીક્ષા આપવાની જાતે બલકેડ તૈયારી પણ ભતાવી હતી !

દીક્ષા લઈને કુવે પડનારને કેમ બચાવાય ?

તેઓશ્રીની એ સુદૃઢ માન્યતાને સુરતથી વિહાર કરી

ગયા બાદ કોઈ સ્વાર્થ સાધુએ ચેનકેનાપિ પલટી નાખવાથી તેઓશ્રીએ ‘અમોએ પૂ.આગમોદ્વારક આ.શ્રીના અર્થને સ્વીકાર્યોં નથી તેમ તેઓશ્રીની બધી પ્રરૂપથાઓને ત્યાંના શ્રી સંઘ વચ્ચે વ્યાપ્યાનપીઠ ઉપરથી બાહેર કરવાનું પણ કહ્યું નથી.’ એમ રથલે રથલે વિપરીત ધોલવાનું અને પ્રચારવાનું શરૂ કરી દીધેલ ! આ સમાચાર ઉપર ઉપર પણ મળવા લાગતાં પૂ. આગમોદ્વારક આ. મ. શ્રીને—‘તેમના જેવા બારિત્રપ્રેમી આવો શાસ્ત્રોછ અને ખુલ્લો મુખવાદ સેવે છે તેમાં અરથુદ્દે તેમને કરાયને સકલશાસ્ત્રપારદ્રષ્ટાપથાના અહુંલાવે પણ મુંજવેલ હોય’ એમ ભાસેલ; પરંતુ ‘દીવો લઇને ફૂવે પડે, તેને કેમ બચાવાય ?’ એ વિચારે તેઓશ્રીની ઉપેક્ષા કરેલ.

### જન્મુવિજયે તો ખાસ ઉપેક્ષા કરવી ઘટતી હતી.

બાદ જાં. ૧૯૬૦ થી ૧૦૬૧ સુધીમાં તો પૂ. આ. શ્રી ડાનસૂરિજી મહારાજે, કોઈ સ્વાર્થસાધુએની ભારી ભીંસના યોગે અઠમાઠને અસેદ ગણુનારી પ્રથમની માન્યતાને જૈન પ્રવચનમાં તેમજ વીરશાસનમાંના પોતાના ૬૭મા પ્રશ્નોત્તરમાં પણ ‘મતાંતરે કરીને ગર્ભથી આડ વર્ષે’ એટલે કે-જન્મથી સાત વર્ષ અને ઉ માસની (કે-કે અર્થ જન્માઠમનો પણ થતો નથી) વયવાળા બાલકને દીક્ષા આપી શકાય.’ એ પ્રમાણે ‘અષ્ટમ’ એટલે ‘આઠમુ’ અણુવાને બદલે ‘આડ’ પૂરા ગણુવાની ભૂતને પણ અભૂતમયપણે બાહેર પ્રચારમાં પણ વહેતી કરવાં પડેલ. બાદ જાં. ૧૯૬૧ના ચૈત્ર મસે પોતાની એ પરાધીનતામાં

જ શાશ્વતી ઓળિની અસજાય લોપવાની ગંભીર થાપ ખાઈ જવા પામીને તેઓશ્રી સં. ૧૯૬૮ના મહામાસે તો કેદી દેશની હૃદમાં નહિ તેવા ‘પાટડી’ નામના ગામડામાં શ્રી પ્રેમ. રામ. અને જંખવાદિની પણ ગેરહુાજરીવાળી સ્થિતિમાં સાથેના પાંચેક સામાન્ય સાધુએ વચ્ચે કાલધર્મ પામી ગયા ! આ પછીથી તો તે ચર્ચાની પૂ. આગમોદ્વારક આ. મ. શ્રીની જેમ તે સ્વર્ગતના સંતાનીયાઓએ પણ ઉપેક્ષા જ કરવી રહેતી હતી, અને તેમાં પણ-સુરતની તે ચર્ચાની શરૂઆતમાં ખતાવવા માંદેલી નિજની વિદ્ધતાની શોખાઈને તે ચર્ચાના અંનભમાં પોતે જ પોતાની મૂર્ખાઈ ગણવવાનું ડહાપણ વનાવવા ભાગ્યવંત ખનેલ તે ચર્ચાના સાધંત જત અનુભવી જંખુવિજયે તો તદ્વસરીય-નિજના અજ્ઞાનાંભરધાતક-પરાભવને દઘિ સ્હામે સદ્ગુરૂના રાખીને સૌ પ્રથમ જ ઉપેક્ષા કરવી ધરતી હતી. અન્યું હતું તે છુપાવીને નહિ ખનેલું ચીતરી માર્યું

તેને બહલે પૂ. દાનસૂરિજી મ. ના કાલધર્મ પછીથી તો તે જંખુવિજયે, તે ચર્ચાને સં. ૧૯૬૮માં વિવિધપ્રક્રોત્તર ભાગ ધીજાની ટિપ્પણીએ વગેરેમાં ‘આઠમ અને અણ્ટ’ શાખનો મનસ્વી પણે જ એક અર્થ કરવા દ્વારા યદ્વાતદ્વા ચીતરીને અત્યંત ચગાવી-જાણે જૈનાગમ-સિદ્ધાંતનો પોતે જ ધનરહાર હોઈને પૂ. આગમોદ્વારક આ. મ. શ્રીની સામે ખુલુંબટે ચડયે હોય તેવા દુંધાણિ પણે તે ચર્ચાને નિર્થક જ અગડં અગડં ખુલ્લકાવી ! અરે ! સં. ૧૯૬૮માં છપાવેલ

કર્મપ્રકૃતિ અને ભાર્ગણ્યાદ્વાર આહિ અંથેાની પ્રસ્તાવનામાં તે સત્યપ્રત્યનિક અને અસત્યપ્રિય વેષધારીએ સુરતની તે ચર્ચા પ્રસંગે જે બન્યું હતું તે તો ખાલકુલ ન જ જણાયું અને જે નહાતું જ બન્યું તે હુંતિની અભીતિ પણ ઉપજવી કાઢીને એ ઘડક ચીનરી માર્યું !

પુ. આગમોદ્વારક આ. શ્રી જેવા પ્રભુશાસનના અનેડ સંરક્ષણશ્રી અને તેઓશ્રીના શાસનપ્રેમી પરિવારને શ્રીસંધમાં ઉતારી પાડના સારુ વર્ષોં સુધી ઓગઅ નામે ગલીય અને ગલીયતર પણ પત્રિકાએ પોતાના શિથ્યો દ્વારા લખાવી છપાવીને ગેઝી રીતે પ્રચારવાનું કુશલ કાવત્રું પણ મુખ્યત્વે આ જંબૂ વિ. કૃત હતું, એમ ગત વર્ષે તેમણે શિથ્યના હાથે ગંદા-ગલીય અને અસહ આશેપોય લખાવી છપાવીને પ્રચારેલ ‘પ્રસ્તાવનાતિભરતરણુ’ બૂકના લખાણમાંથી પકડાઈ જવા પામીને ‘નવામતિના વિવેકદર્શનનું પ્રદર્શન’ નામની બૂકમાં અમારા હાથે પ્રસિદ્ધ પણ થઈ જવા પામેલ હોવાથી પરસુત લખાણમાં તે જંબૂવિજ્ઞયને ‘શ્રી’ થી સંભોધના તે પણ અનુચિત માનવું થએલ હોઈ ‘જંબૂવિજ્ઞય’ તરીકે સંભોધનાનું રાખેલ છે.]

શુદ્ધપ્રકૃતગુણના પ્રભાવે આવ્યા મળેલ સત્યનો હુત !

તેવામાં પુ. આગમોદ્વારક આ. મ. શ્રીના આજુનન અનેડ અને સર્વત્ર નીડરતાથી છલકાતા સત્યપ્રકૃતપક ગુણના અદ્ભુત અને અચિન્ત્ય પ્રભાવે સં. ૧૯૯૩માં પ્રસિદ્ધ થએલ

તે 'કર્મપ્રકૃતિ' અંથની-તે પ્રકારના તે જંખૂવિજ્યે કરેલી-તે જુડી લખાણુમય પ્રસ્તાવના, સુરતની તે સં. ૧૯૮૮ની 'અધ્યમાષ્ટ' અંગેની ચર્ચાના જેઓ સાધંત અનુભવી હતા તે સુરતના વતની સુશ્રાવક શોઠ અમીચંહ ગોવીંદજી શાંક ડ્વોકેટના વાંચવામાં આવતાં તે સત્યપ્રેમી સુશ્રાવકે, આગલ જણાંયું છે તેમ-આશ્ર્ય અને એદ્યાપ્તદિવે (ઉપર જણાવાચેલ નકલવાળો) મૂલ પત્ર તુરત લખીને તે જ વખતે (આજથી ૩૧ વર્ષ પૂર્વે) પૂ. આગમોદ્વારક આ. મ. શ્રી ઉપર રવાના કરેલ ! સત્યનો તે પત્રરૂપ દૂત મળ્યા પણી પૂ. આગમોદ્વારક આ. મ. શ્રીએ, સં. ૧૯૮૮ના શ્રીસિદ્ધચક્રપાલિક વર્ષ ૬ વૈ. શુ. ૧૫ના છિઠ્પુ અંકના પુ. ૩૪૮ ઉપરની અંતિમ ૭ નંખરની સમાલોચનામાં નીચે પ્રમાણે જાહેરાત પણ કરી હતી.

### શ્રીયુત શાહ એડવોકેટના પત્ર પરથી જાહેરાત

“૭-સુરતની અધ્યમાષ્ટ અલેદવાદીઓની પીછેઝડ માટેનો એક કાગલ પણ તૈયાર છે, આવો તો ખતાવાય.”

### જંખૂવિ. તો આવો પણ શું સુખ લઈને ?

એ જાહેરાતને પૂ. આ. શ્રી દાનસૂરિજી મ. બાંદ તેઓ શ્રીના શ્રી પ્રેમ.રામ. આર્દ્વિશાલ પરિવારે વાંચેલ હેવા છતાં તે પત્રને વાંચીને શ્રીદાનસૂરિજીની તે વખતની પીછેઝડની ખાત્રી કરી જવા તે પરિવારમાંનો એકાદ પણ સાધુ પૂ. આગમોદ્વારક આ. મ. શ્રીની હૃદાતિના તે પછીના ૧૨ વર્ષ સુધીમાં આવી

શકેલ નથી ! એ પીઠેહણા જાત અનુભવી જંખૂવિજ્ય તો  
આવે પણ શું મુખ લઈને ?

**અવતરણ :-** સુશ્રાવક અમીયંદ ગોવીંદજી શાહ  
ઓડવેકેટ (સુરત) તરફનો તા. ૨૧-૧૦-૬૭ આસો વહિ ઉ  
શનિવારનો પ્રથમ જલ્દુવેલ છે તે પત્ર, (સં. ૧૯૯૭ના પત્રની  
નકલ સાથેનો) અમોને અત્ર-વાંકાનેર મુકામે મળતાં અમોએ  
અત્રેથી તેઓશ્રીને ગત વર્ષે પ્રસિદ્ધ કરેલ ‘નવામતિના  
વિવેકદર્શાનનું પ્રદર્શાન’ નામની ખૂક, તેના પૃ. ૩૨  
ઉપરના—“તેવામાં મુંબઈથી આવી રહેલ પૂ. આ. શ્રી  
દાનસૂરિજી મ. પણ અમો સૌ સાધુના સ્વાગત સહિત શ્રી  
જંખૂવિ. આદિ પરિવાર સાથે સુરત પધારેલ,——થી પ્રારંભીને  
પૃ. ૩૩ ઉપરના પહેલા કોલમની—‘છતાં દૂર ગયા ખાદ વળી  
પાછા પ્રાય: સર્વત્ર ‘અમારી માન્યતા સાચી છે’ એમ બોલવા  
અને પ્રચારના લાગ્યા ! આથી ‘તેઓશ્રીની આ કંઈ જતની  
પ્રમાણિકતા ?’ એમ આશ્ર્વય થયેલ ” એ અંતિમ પંક્તિએ  
પદ્યંતના લખાણુની જે સત્યતા હોય તો તેમ જલ્દુવા તે  
લખાણ પર લાલસાઈન કરીને મોક્ષેત અને તે સાથે (તે  
ખૂકના તે લખાણમાં અમે એ લખાણુની સત્યતા માટે ૩૦  
વર્ષ પહેલા છપાયેલ ‘હિંદ્યા-ઇરવો’ ખૂકનાં પાનાં ૬-૭  
ઉપરલું લખાણ પણ જેવાનું જલ્દુવેલ હાનાથી) તેઓશ્રીને  
અત્રેથી તે ‘હિંદ્યા-ઇરવો’ ખૂકમાંનું પણ લખાણ ઉતારીને જે  
પત્ર લખેલ તે અમારા પત્રને પણ આ નીચે અક્ષરશઃ ૨જી  
કસ્વામાં આવે છે.

શ્રીચુત શાહને મેં લખેલ પત્રની નકલ

ઉપાધ્યાય હંસસાગર શ્રીસ્થલ-વાંકાનેર તા. ૨૩-૧૦-૬૭  
દે. કૈન ઉપાશ્રય } આસો વદ પ સોમવાર

હેવ ગુરુભક્તિકારક પુણ્યપ્રભાવક સુશ્રાવક અમીયંદ્લાઈ  
ગોપીંદળ એડવોકેટ યોગ-લાગણીપૂર્વક ધર્મલાલ વાંચશો.

તમારો તા. ૨૧-૧૦-૬૭ આસો વદ ઉ ને શનિવારનો  
પત્ર, તા. ૬-૧-૧૯૮૮ પોષ વદ ૮ ને રવીના પત્રની નકલ  
સહિત મળ્યો. શાસનસેવા અંગેનો લાલ લેવાની શુભેચ્છા  
જાણી અતિ આનંદ.

આજે તમોને વર્તમાનમાં ઉપડેલી ચર્ચાની માહિતી માટે  
અત્રેથી ઉ ખૂકો ખૂકોસ્ટથી મોકદી છે. મળ્યેથી પહોંચ  
જણુવશો.

પુ. આચાર્ય મ. શ્રી આનન્દસાગર સ્લૂરીથરળ મ. સં.  
૧૯૮૮માં સુરત ગોપીપુરા નેમુલાઈની વાડીના ઉપાશ્રે  
ખિરાજતા હતા તે અરસામાં મુંખાઈથી વિહાર કરતા પુ. આ.  
શ્રી દાનસ્તુરિલુ મ. પણુ સુરત તે જ ઉપાશ્રે પદ્ધાર્યા હતા.  
તે પ્રયત્ને ‘દીક્ષાની જગન્ય વય’ અંગેના અણ્ટમ શર્ષદ  
અંગેની ઉક્ત બંને આચાર્યો વચ્ચે થએલ ચર્ચા અને તે  
ચર્ચાના આવેલ સુંદર પરિણામ પર્યાત તમો-શેઠ નેમચંદ  
નાથાભાઈ તથા શેઠ મગનલાલ રણુછોડલાઈએ સારો પ્રયાસ  
કર્યો હતો.

આથી તમોને જણુવવાનું કે-તે ચર્ચાના પરિણામ પર્યાતની  
મેં સં. ૧૯૯૨માં પ્રસિદ્ધ કરેલ-‘હિશા ફેરોચા’ નામની

ખૂકના પેજ ૬ થી ૭ ઉપર લખેવી—“સં. ૧૯૮૮માં શ્રી સુરત મુકામે પધારેલા તે વખતે આપ (પં. રામવિ.) તો તેમની સાથે નહોતા, પણ શ્રી જંબૂવિજયજી મહારાજ વિગેર હતા અને આવી અનેક ચર્ચાઓ ‘સુરતમાં પૂ. શ્રી સાગરજી મહારાજ પણ હોવાથી’ ચર્ચાથી હતી. પસ્તિથી આપનો મત સદંતર ઓટો છે એમ જાહેર થવાનો ટાઈમ આવ્યો. ત્યારે-સુરતના રહેવાસી શ્રાવક અમીચંદ ગોવીંદજી એડવેકેન્ટ, શ્રાવક નેમચંદભાઈ નાથા તથા શ્રાવક મગનલાલ રણુંઠેડ મળીને ત્રણુ ભાગ્યવાનો-શેઠ નેમુલાઈની વાડીના જુના ઉપાશ્રયમાં (જે હાલ નવો બંધાયો છે) પૂ. શ્રી સાગરજી મહારાજ પાસે આવ્યા હતા અને તે વખતે પરમારાધ્ય પૂ. ગુરુદેવશ્રી ચંદ્રસાગરજી મહારાજ સાહેબ, હું (કંસસાગર) તેમજ નગીન કપુરચંદના પુત્ર નાતુભાઈ હાઈર હતા, તે ત્રણેય શ્રાવકોએ કહ્યું કે— ‘સાહેં ! દાનસુરીખરજી મહારાજ કહેવરાને છે કે—‘આપની જે જે પ્રદૃગ્ઘણ્યાયો છે તે તે અમોને માન્ય છે અને આવની કાલેજ વ્યાખ્યાનપાટે જોખીને હું પોતે તેવું જાહેર કરું એવી મારી ભાવના છે; (કેટકા ઉચ્ચ મહાતમા !) પણ આપની ધૂઢ્ધા હોય તો શ્રી જંબૂવિજયજી મહારાજ વ્યાખ્યાનમાં તે પ્રમાણે જાહેર કરે !’

આશ્રી વાત તે શ્રાવકો કરી રહ્યા કે તુર્તજ પૂ. સાગરજી મહારાજાએ કહી દીધું કે તેમ હોય જ નહિ ! એમનાં લાજ તે મારી લાજ છે ! આશ્રી કખુંજ કયું તે જ ખર છે ! જાહેર એલાવવાથી શું વિશેષ છે ?” અને સાથે

અમોને પણ પુ. શ્રી સાગરજી મહારાજાએ કૃમાવી દીધું કે ‘હુએથી કોઈપણ સાધુએ દાનસૂરિજીના મતલેહો કોઈના પણ સુખે ચર્ચાવા નહિ અને ચર્ચાશે તો પ્રાયશ્ક્રિત આપીશા.’

એ વાત જે ખરાખર હોય તો તે વાત મુજબનું માર્ઝ સ્ટેટમેન્ટ ટાઇપ રાઈટીંગમાં કરાવી તેની નીચે આપની સહી કરીને અને એથીય વધુમાં જે ત્યાંના નામહાર મેળુસ્ટેટ સાહેબના પણ સહી સિક્કાપૂર્વક મને મોકલી આપો, એમ શાસનના લાવિ ધણ્ણા છિતની દઘિએ આથી જણાવું છું.

આ લખતો હતો ત્યારે આપનો તા. ૨૨-૧૦-૬૭ નો ક્યાડ મળ્યો છે. આપના લખાણુની પ્રસિદ્ધ પ્રસંગે ક્યાડમાં સૂચવેલી ખીના પણ મહત્વનો લાલ કરનારી નીવડશો. ધર્મલાલ.

### શ્રીયુત એડવોકેટ શાહનો આવેલો જવાબ

|                     |                                                  |
|---------------------|--------------------------------------------------|
| અમીચંદ ગોવીંદજી શાહ | નવાપુરા, કરવા રોડ<br>બી. એ. (ઓનાર્સ) એલ. એલ. બી. |
|---------------------|--------------------------------------------------|

|         |                |
|---------|----------------|
| એડવોકેટ | તા. ૨૫-૧૦-૧૬૬૭ |
|---------|----------------|

|                                                                                                               |  |
|---------------------------------------------------------------------------------------------------------------|--|
| પરમ પૂજય ઉપાધ્યાય શ્રી હંસસાગરજી ગણ્ણુ સુ. વાંકનેર<br>આપશ્રીના તા. ૨૩-૧૦-૬૭ના પત્રના જવાખમાં<br>જણાવવાનું કે- |  |
|---------------------------------------------------------------------------------------------------------------|--|

સંવત ૧૯૮૮માં પ.પુ.દાનસૂરિજી તથા પ.પુ.સાગરજી વચ્ચે અધ્યમ વિ. ચર્ચા થઈ એકમતિ થઈ હતા એ હકીકત હમારી રંગર અની હતી તે સત્ય છે.. અને તમારા ‘દિશા ફેર્વો’ પુસ્તકમાં પા. ૬ થી ૭ માં લગેલી હકીકત, તેમજ ‘પ્રવર્ગયા યોગાદિવિધિ

સંશોધ પ્રસ્તાવના તિમિર ભાસ્કર'માં પા. ૪૩ ઉપર લખેલી હકીકતો પણ સત્ય છે. તેમજ પ. પુ. સાગરજી પરના મારા તા. ૯-૧-૧૯૩૮ના પત્રની તમેને મોકલેલ નકલથી પણ ઉપર લખેલી હકીકતોને બરાબર સમર્થન મળશે. વિ.માં હું સાધુમહારાજેના કોઈ અગડામાં પડતો નથી અને પડવા માગતો નથી તેની નોંધ કેશોજી. કામકાજ સેવા ફરમાવશોજી.

દી:

આમીચંદ ગોવિંદજી શાહના  
અનેકાનેક વંદના સ્વીકારશો.

ઉ...પ...સ...ં...હ...ર

સં. ૧૯૮૮ની વડોદરા દીક્ષા નિયામક કમિટિમાં ખુહારી સં. ૧૯૮૮નો પુ. કમલસૂરિજી મ. ના નામનો આ. શ્રી લભિધસ્તુ. ની સહીવાળો બનાવઠી પત્ર રબ્જુ કરવામાં, સંક્રમકરણુ લાગ બીજામાંની-નિજનો ઉત્કર્ષ અને અનિષ્ટ માનેલાંનો અપકર્ષ ચીતરેલી-પ્રસ્તાવનામાં અને સં. ૧૯૮૮ની પદૃધરની (અનિષ્ટને પદૃધરપદ્ધુમાંથી ઉડાવા ટેવાના કાવાદાવામય) નિર્દ્યક ચર્ચામાં અસત્ય લખાએનો કરવાનાં પડી ગયેલી ટેવને વશવત્તાં બનીને નવા વર્ગના જંબૂવિન્દે ઉપર જણાવ્યા સુજબ તેમના ગત વર્ષની-'પ્રસ્તાવનાતિમિરતરણિયુ' નામની ખૂકમાંના પુ. ૪૮ ૪૮ ઉપર 'કોણું પૂછનાર છે?' એમ ધારીને (મારી ગત વર્ષની 'પ્રસ્તાવનાતિમિરતભાસ્કર' ખૂકમાંની (સં. ૧૯૮૮માં સુરત થયેલી 'આટમ'ની ચર્ચાવાળી વાતમાં) મને ઉદેશીને "તના ગુરુએ તરફથી સાચું ઓલવાનું ચિકષણ મળ્યું જ ન

હોઈને તેઓ જુહું ખોલવામાં જરાયે ગાંજ્યા જાય તેમ નથી. \*\*\*  
તેમણે લખેલી—‘પુ. દાનસુરિજીએ પુ. આગમોદ્વારક આ. મ.  
શ્રીની તમામ પ્રરૂપણાંઓ મારે સ્વીકાર્ય હોવાનું ત્રણ શ્રાવકો  
સાથે કહેવડાયું’ એ વાત સીતા રાવણનો સ્વીકાર કરવાનું  
કહેવડાવે; તેવી ધરાર જુઠી છે” હત્યાહિ ખલજનોચિત  
આશ્રેપાત્મક લખાણ કરાવીને છેવટે—‘એવી કોણ બીના બની જ  
નથી’ એમ પણ લખાવી નાખવાનું દુસ્સાહસ કરેલ છે!

પરંતુ સત્યના સેવકનું સત્ય આ દુષ્ટમકાઢે પણ  
શાસનદેવ જગ્યાકાવવા સજાર હોવાની ખાત્રી આપતું-તે સં  
૧૯૮૮માં સુરત થએલ ચર્ચા અંગેનું આ ઉપરનું આદિથી  
અંત પર્યાતનું-સમય લખાણ મધ્યસ્થ ભાવે વેધક દળિએ  
વાંચવાથી સુઝજનોને ખાત્રી થશે કે—“પોતાની ‘અષ્ટમ’ નો  
‘અષ્ટ’ એવો જોટો અર્થ કરીને ચાલવાની અભૂધજનયાદ્ય  
વાતને સાચી લેખાવતા રહેવાના દુરાથ્રહવશાતું જ ધરાર જુડાઈનો  
સ્વાંગ ધરીને જંબૂલિંગે મારી તે સં. ૧૯૮૮માં સુરત થએદી ચર્ચાની  
અક્ષરદાઃ સત્યબીના બદ્ધ મને એ પ્રકારે જે ધરાર જુહું  
લખનાર તરીકે જણાવવાનું બનેલ છે, તથા ઉપરંભાએ રાવણનો  
સ્વીકાર કરવાનું કહેવડાવેતું જ’ એમ જણુવા છતાં સીતાના  
ખાને તે વાતને પણ અસત્ય લેખાવવાનું પાપ કરાવવું પડેલ  
છે. બાકી સં. ૧૯૮૮માં સુરત થએદી ચર્ચામાં પુ. આ.  
શ્રી દાનસુરિજીએ પોતાની ‘અષ્ટમ’ના અર્થનો ભૂવનો સ્વીકાર  
કરવા ઉપરાંત પુ. આગમોદ્વારક આ. મ. શ્રી નાં તમામ જ  
પ્રરૂપણાંઓનો પણ સ્વાકાર કરેલ હોવાની વાત તો દીવા જેવી જ  
છે, એમ તો તે જંબૂલિંગ્ય પણ જણે જ છે, છતાં નિહંવે છે.”

**અવતરણુ : -** સં. ૧૯૫૨-૬૧ અને ૮૬માં તે વર્ગો, ભા. શુ. ઉદ્ઘાત ચૈથના અલુગળ ખાને ભા. શુ. ૫ ના કથયવાળા શ્રી સંધસ્તીકૃત ચંડાંશુચંડુપંચાંગને તે તિથિના એક જ હિસ માટે છોડીને શ્રીસંધને બહિ માન્ય એવા ભા. શુ. ૬ના કથયવાળા અન્ય કોઈપણ પંચાંગને-તેવા વિચારવાળા વધુ જણુના તોરમાં-પકડીને ઉદ્ઘાત ચૈથે સંવત્સરી કરવાનું અધિત આચરણ કરેલ, ત્યારે શાસનપક્ષ તરફથી તેમને કહેવામાં આવેલ કે-“એ રીતે એક હિસ માટે શ્રીસંધ-માન્ય પંચાંગ છોડી કું અને બીજા હિસથો તો પાછું તે જે તે જ પંચાંગ આદરનું ! એ તો ઘેલીના ફેરણા જેવી વાત છે : છતાં જૂથના બળે એક હિસને માટે તે જંધમાન્ય પંચાંગને છોડીને જે અન્ય કોઈ બીજું પંચાંગ આદરી શકો છે, તો તે બીજા પંચાંગના આધારે પણ કારણ ચાલવાનું સંધથી નક્કી કરો તો તેમાં કાંઈક તો ઝડપણું મનાય.”

શાસનપક્ષની તે સત્તાફથી તે વર્ગો, તેવા પ્રસંગે એ પ્રકારે બીજા પંચાંગનું શરણ લેવામાં પોતે પણ પોતાને અવિચારી માનતો થયેલ.

ગર્નિયામે જ્યારે સં. ૧૯૬૬રના ચંડાંશુચંડુ પંચાંગનાં ભા.૦ શુ.૦ એ પાંચમ આવેલ, ત્યારે અન્ય પંચાંગમાં ભા.૦શુ.૦ ૬ એ હોવા છતાં તે વખતે તે વર્ગો એ ૬ વાપું અન્ય પંચાંગ લેપું બંધ તો કર્યું જ; પરંતુ ચંડાંશુચંડુ પંચાંગમાંની તે લૌકિક એ પાંચગને આરાધનાના લોકોત્તર જૌનપંચાંગમાં પણ એ પાંચમ મનસ્તીપણે જ માનવાનો નથો જ તુલ્કો રહ્યો !

એમના સમુહાય સિવાયના કેટલાય સાધુભગવંતોના વંદન  
બંધ કરાવી હેત.

શ્રી રામસૂરિજી મહારાજને શ્રી રતિલાલ લુલાખાલે  
એકવાર રૂખર કહેલું કે-પુનઃ નેમિસૂરિજી મહારાજના  
સંઘાડામાં અંશુચર્યાનું પાલન બહુ કરું રીતે થાય છે, એ  
આનંદની વાત છે. ત્યારે આ નવામતિસૂરિજી એલેલા કે-  
'ચક્રવર્તીનો ઘોડો પણ અંશુચર્યા પાળે છે !' આ રીતે એમને  
મન અંશુચર્યાની કિંમત જ નહોતી. એ સાંભળાને શ્રી રતિભાઈ  
પણ હેઠતાઈ ગયા હતા.

શાનાવરણીય કર્મ બાંધવાનું તો એમને ડગલે ને પગલે  
હતું. એકવાર વલ્લભસૂરિજી મહારાજ વિરુદ્ધ ગાંધી  
પત્રિકાએ નનામી છપાવેલી, પોલીસને ભાળ  
મળી ગઇ, ઉપાશ્રયમાં પડી હતી, પકડાય તો કેસ  
થાય. બહુ-શિક્ષા થાય તેમ હતું. એટલે ભૂગર્ભ  
ગઢરમાં આપે આપો થોકડો નાખી હેવાની  
શ્રી રામસૂરિજીએ રતિલાલ લુલાખાલાને આજા  
કરી. રતિભાઈ નાખી પણ આંદ્યા ! હવે એ કહે છે  
કે 'કોઈ પૂર્વભવના પાપને લીધે હાથ તો કુંઠો છે, છતાં આ  
હાથે મેં શાનાવરણીય કર્મ પણ રામસૂરિના સંગે આ રીતે  
બાંધ્યા છે, હું કયા લવે છુટીશ ?'

વદી એક બીજી વાત પણ તેમણે મને કરી હતી કે-  
'રાત્રે માત્રું કરવા ઉપાશ્રયની બહાર જતાં અને લીલોતરી  
ઉપર ચાલતાં મેં સગી આંખે નેયા છે.' એટલે જ શ્રી

રતિભાઈ જે પહેલા તેમના પ્રત્યે ખુબ રાગી હતા તે ન રહ્યા. ૧૯૮૮ નું ચોમાસું પણ વદવાલુમાં તેમણે જ મહેનત લઈ કરાવેલ, પણ એ ચોમાસામાં ક્યારે ચુવકસંઘવાળાએ કેટલીક નહિ કહેવા જેવી અને નહિ લખવા જેવી બાખતો રતિભાઈના કાન પર મૂકી, સાખિતીએ પણ બતાવી, ત્યારથી રામસૂરિલુને એ પૂર્ણરીતે ચોળાયા ગયા; પણ જૈનસાધુતું બહાર ન બોલાય શાકન નિંદાય એટલે મૌન ધારીને રહેવા છે, અને પહેલા તે આગરણમહારાજને જુદી ગણુતા હતા તે ભૂત પણ તેમણે સુધ્યારી લીધી છે.

આ થઈ આડી વાત, પણ જરૂરી લાગી એટલે લખી છે. આ. શ્રી વિજયપ્રેમસૂરિલુ મ. ને અને શ્રી સમસુરિલુને નહેતું બનતું એ વાતને પણ આપે ઠીક ઠીક ખુલ્લી કરી છે. એટલે ગુરુના નામે ચરી આવાનું બંધ થાયઃ ઠીક પડે ત્યારે ગુરુને ગાગો હેરી અને ઠીક પડે ત્યારે ગુરુને આગળ કરવા આ એમની કાયમના રમત હતી.

૧૯૮૮ ના વદવાલુના ચોમાસામાં આચાર્ય શ્રી દાનસુરિલુ મહારાજની સ્થિતિ તો શ્રી રામવિજયજીએ ફેઝેડી કરી મૂકેલ અને ત્યારથી તેઓ બળતા હતા, પણ વ્યાખ્યાનકાર જખરા એટલે પોતાને પણ તે ઉતારી પાડ્યો તો ? એ વગેરે બીકે મુંઝાઈ મુંઝાઈને તેઓ રહેતા હતા, એ વાત પણ અસ્થરશઃ સત્ય છે.

અને એલ્લે વૈદને ફેડવા બાબતનું કાવત્રુ આપેજે પકડી પાડયું તે તો જગ બહેર વાત છે. સૂર્યને બતાવવા કાંઈ દીવો બોડો કરવો પડે ? સુધ્યે જ સ્વયં પ્રકાશિત છે, એમ વૈદને ફેડવા બાબતના પુંકળ

મહાન કલેશનું કારણ છાશવારે ઉલું કરે છે એ  
નક્કી હવે તો તેમને માનનારા વર્ગને પણ લાગશે જ.

ડાખોઈ સુકૃતાભાઈ શાનમંહિર બાબતનો ઉદ્દેશ્ય પણ  
મનનીય છે.

પેજ ૧ થી ૩૧ સુધીમાં જે ઈતિહાસ આપે રજુ કરેલ  
છે, તે અક્ષરશઃ સત્ય છે. કારણ કે-તેમાંની ઘણી વાતો મને  
૧૯૬૬-૬૭માં પ્રાપ્ત થઈ હતી અને આધાર લાયક પણ હતી;  
પરંતુ વધુ પડતા ભારા દ્વારા રાગના કારણે એમાં  
શાસનને કાંઈક ફાયદો હશે એમ માનીને મેં  
ગણુકારી નહોતી. વલી એ પક્ષના જુડાણુંમાં ફાયદો  
હું પૂર્ણ સાગરજી મ. સાહેબ સામે પણ પૂર્વ-  
ગ્રહીત હતો. તેમને હું જુદી અને આગાહી ગણુંતો  
હતો. કારણ કે-એ પક્ષવાળાને એ એ શબ્દો બહુ  
સારી રીતે પ્રચારમાં સુકૃતા આવડતા હતા. ‘શ્રી  
સાગરજી મહારાજ જાની તો ઘણું છે, પણ અમુક વખતે  
કાંઈક પકડાઈ જાય છે પછી એ છાડતા જ નથી’ એમ કહીને  
‘સંઘના મોટાભાગે શ્રી આત્મારામજી મહારાજે પાંચમના બદલે  
જઈનો ક્ષય કરવાની કરેલી આજા સ્વીકારેલી અને ઇકત્તા  
શ્રી સાગરજી મહારાજ અને તેમના થોડા જ સાધુઓએ ત્રીજીનો  
ક્ષય કરેલો, એ વાતને બહુ ચંગાવતા હતા. આથી હું અને  
મારા જેવા અન્ય, શ્રી સાગરજી મહારાજ પ્રત્યે પૂર્વગ્રહિત  
થઈ ગયા હતા, આ એક નક્કર હડીકત છે

ચોમાસાની દીક્ષા અને જખાણમવાળા પ્રકરણો નવામતી-ઓના અશાનતું પ્રદર્શન કરે છે અને યેનેને શ્રી સાગરજી મહારાજને ઉતારી જ પાઠવાની મેલી મુરાહ કેટલી હદ સુધી હતી તે પ્રકાશમાં આણે છે.

આચાર્ય શ્રી દાનસૂરિજીએ લૂલ લખે કણુલ કરી પણ એ ભૂલ કર્યા વખતે કેટલા હાજર હતા ? વળી અમુક વરસે માણસો ભૂલી પણ બાય, એટલે અમુક સમય જયા પછી પાછેા નિંદ્ય પ્રચાર શરૂ કરી 'વાનો તો એ ધંધો લઈ એઠા હોય પછી અવજું શું ન પ્રચારે ?

પેજ ૩૫-વિવિધ પ્રશ્નોત્તર ના બીજા ભાગમાં ૧૭૯૮મો ફૂટ પ્રશ્નોત્તર ઉપલવી કાઢનારાને બીજા મહાવતની પરવા પણ ક્યાં હતી ?

આ નવામતીઓએ શ્રી વલ્લભસૂરીધરજી મહારાજ વિરુદ્ધ બોલવામાં તો માણિ મૂર્ઝી દીધી હતી, પણ અમે દ્રષ્ટિરાગવાળા એ વખતે એ બધું સાચું જ માનતા હવા અને ચોથી તો મેં શ્રીપદ્ધલભસૂરિજી મહારાજ ધ્રાગ્યા પધારેલા ત્યારે વંદના પણ નહીં કરેલ : કારણ કે- વલ્લભસૂરિજીને વંદના કુર્વાથી પાપ થાય છે વિગેર તેઓએ અમને ઠસાવી દીધેલ; છતાં સંમેલનમાં એવું બોલ્યું કે-'અમારે કાંઈ વ ધોા નથી' ત્યારે જુહાણુંની હદ વળોટી ગયા કે બીજું કાંઈ ?

'હિશા ફેરવો' મેં ખુલ વાંચેલ છે, અને તેમાં આ નવા મતવાદીઓના જુહાણુને જે પડકાર આપ્યો છે તેને દીપે જ તેમના હાડ ગાળવા લાગ્યા હવા, નહીં તો આ હોકો

પૂરાવાર્દ્દે “પર્વતિથિનિર્ણય” અંથ કે-જેમાં શાસનના આધાર-સ્થંલોના પત્રો-અભિપ્રાયો વિગેરે પણું પ્રસિદ્ધ થયેલ છે અને શાસ્ત્ર અને પરંપરાના આધારો પણું આપેલા છે, તેમજ વૈદને ફોડવાના પુરાવાયો પણું બહાર પાડેલા છે. એટલે એ પુરુષક દ્વારા તો આપે ખુબ ખુબ શાસનસેવા અથવા તો કહો કે-આપે આપની પવિત્ર કુરજ બળવી છે. એ દળદાર અંથને મેં અનેકવાર વાંચ્યો છે, છતાં પણું વારંવાર વાંચવાનું મન થયા કરે છે ! એટલે એને લગતી હકીકતો પણું આપના આ પુરુષકમાં જે રજુ કરી છે તે યોગ્ય જ કર્યું છે.

અને છેલ્દે—‘વિવેકદર્શન’ બહાર પાડનારમાં સાધુપણું તો કયાંથી હોય ? પણું લદ્રિક શ્રાવકમાંથી પણું નોચે ગયેલ જણ્યાય છે. નહીં તો આટલા બધા જુઠાણું તે શા માટે છપાવે ?

‘તપાગચ્છભક્ષક’ શ્રી સાગરજ મહારાજને કહેવાવાળાને ખબર નથી લાગતી કે- શ્રી રામસૂરિજ અને જંબુવિજયજ સાધુગુણુભક્ષક જ છે. નહીં તો પાયાર્દ્પ પાંચ મહાત્મતોના પાલનમાં શા માટે ઐદરકારી દાખવે ? શા માટે ભાગીધુંઝીને મહાત્મતોનું અંડન કરે ?

શ્રી જંબુવિજયજનું વઢવાણું એક વ્યાખ્યાન પણ બાદ આવે છે. તેમણે કહેલું કે—“તમે બધા સાતે ય વ્યસનો-માંથી છ વ્યસનો. તો સેવો છો : જુઓ-શિકાર તો જણે દુકાને એઠા હો ત્યારથી જ શોધવામાં મશગુલ હો છો, એટલે કે-હમણાં કોઈક આવે અને એને છેતરનું : પછી ચોરી તો

ધણી કરો છો. એછું આપવાની, કર નહીં ભરવાની વિગેરે. અને પરસ્કી સામે શું તમે નજર કર્યા વિના રહો છો ખરા ? નાટક પણ જેવા જાવ ત્યારે શું પરસ્કીને નથી જેતા ? અને જુગાર તો તમે જે સટ્ટાના વેપાર કરો છો તેમાં શું હેર છે ? અને દ્વામાં પણ દાડું માંસ તો તમે વાપરો જ છો ! હુને છેલ્લે રહી વેશ્યાની બાબત : એથી તમે અલગા હો એ બને, ખાડી છ વ્યસનો તો તમે રાત દહ્યાડો સેવો છો. પછી તેણે શ્વેચાક પણ અવળો કહેલો. એટલે કે-ખીજું પાં પહેલું જણાવીને કહેલ કે- પાપર્ધિ ચૌર્ય પરદારસેતા, ધૂત ચ માંસ ચ સુરા ચ વેશ્યા । એતાનિ સાત વ્યસનાનિ લોકે, ધોરાતિંધાર નરકં (નયાંતિ ને બદલે) બ્રજન્તિ ॥ આવા ધોર નરકમાં લઈ જનારા સાત વ્યસનોમાંથી છ વ્યસનો તમે સેવતા હોવા છતાં તમે પાંચમે ગુણુઠાણે છો એમ કઈ રીતે તમે કહી શકો ? ”

(તે બદલ મારે તરત પૂછું હતું કે-શ્રાવકને અર્થદંડ તો કહેલ છે તેમાં તે છ વ્યસન કયાંઈ કહ્યા છે ? પણ પૂછ્યું ન હેઠું.)

મને તો એમ પણ પૂછવાનું મન થયેલ કે- “તમે છે ગુણુઠાણે ગણ્યાવ છો તેમાં તમે પણ ‘કોઈ આવે ને અમૃત કામ કઠાનું’ વિગેરે પ્રકારે તે છયે વ્યસનો સેવતા જણ્યાવ છો એટલે વેશથી સાધુ છો.” છતાં નહીં પૂછવાનું કારણ-તેમના અંધશ્રદ્ધાળુંએ આગળ જ બેઠા હતા, નાહક વ્યાખ્યાનમાં ધાંધલ થઈ જવાનો ભય લાગેલો. એટલે પૂછવાનું માંડી વાળેલું અને પછી વ્યાખ્યાનમાં જવાનું પણ માંડી વાળેલ.

સાહિત્યની ખબર પડી. તેવા પ્રકાશન કરતાં આગમીક સાહિત્યનું પ્રકાશન કરે, આવા જગડા મૂકી હે તો સારું. બાકી મૂળથી જ ઓટા પ્રચાર કરવામાં પાવરધા છે. સામાને ઉતારી પાડવા એ એનો સિદ્ધાંત છે. પૂ. સ્વ. વિજયવલલસૂરીધરજી મ. માટે ધણો તેરી પ્રચાર કર્યો, પણ ક્ષાંયા નહિ. અંતે એ તિથિ કાઢી ! તે પણ અંતે મૂકવી પડી ! છતાં હજુ બીજુ બીજુ રીતે ઓટા પ્રચાર કરતા થાકતા નથી ! પણ તમો સાચા દાખલા-દદ્વારે આપી ખુલાસા જાહેર કરો છો એટકે વાચકેને સાચી બીનાની સમજ સારી પડે તેમ છે.

**પં. શ્રી ચંદ્રનાનદીય (જ મ) ગણ્ણી વડોદરા**

આસો વહ જ ખુધ

૬- આપની ‘વિવેકદર્શનનું-પ્રદર્શન’ ખૂક મળી. નવા મતની હુર્ગંધીપદાર્થને પણ શરમાવે તેવી ગંધી ભાષાપૂર્ણ લખાણુવાળી ખૂક તેનેથી શોભાસ્પદ નથી. આપે નવામતવાાા-ઓને તે હુન્નાતિમાંથી સન્માર્ગે લાવવાની સહખુદ્વિચે તે તે પ્રસંગોના પૂરાવાચો આપવા સાથે શાખ્યપૂરાવાચો પણ આપીને સચોટ પ્રતિકાર કર્યો છે. આતો ભગવાન મહાવીર પ્રભુનો માર્ગ છે : તેમાં કલિપત ગરૂપાં ન જ ચાલે. ગોશાલા જેવા જખરા વિરોધીનાં પણ ગરૂપાં ન જ ચાલ્યાં. આપનું લખાણુ, સત્યપ્રદપણું કરવાની નીડરાપૂર્ણ ધગશને મૂર્તિસ્વરૂપ આપી રહ્યું છે. આ પુસ્તકમાં આપનો લાવદ્યાયુંતા જે પ્રયાસ થએલ છે તે ખરેખર પ્રશંસનીય છે. બિરુદ્ધને સફલ કર્યું ! ધન્ય છે !

(પં. શ્રી) સુર્યસાગર (લુ મ.) અમદાવાદ આસો વદ ૬

૧૦- મોકાવાનેલ 'વિવેકદર્શનનું-પ્રદર્શન' પુસ્તિકા મળી. સાધ્યાંત વાંચી છે. 'શ્રીશાખેશ્વર પાર્થીનાથ અને વિવેકદર્શન' ખૂકમાંના ગાળોના સમાદ્ર નિત્યાનંદ વિ ના નિંઘતર લખાણે શ્રી સંધની શાંતિમાં અર્થશૂન્ય વિસેપ જલો કર્યો છે. તેમની પુસ્તિકામાંના-વાંચતાં જ ઉશ્કેરાટ પેઢા કરાવે તેવા અંગત, ઉપજલી કાઢેલા અને ગલીચ-આક્ષેપોને પણ આપે પીઠ જઈને તેમની એકેએક વાતના વગર આવેશે અને પ્રૌદ્ભાષાથી વણી વણીને સુંદર અને સચોટ ઉત્તરો આપવા વડે પુસ્તિકાને સર્વજનપ્રિય બનાવી છે, જેનસમાજને તેઓથી સજાગ કરી દેવાનું ભગીરથ કાર્ય કર્યું છે અને તેના સુંદર ફૂલ તરીકે પ્રભુશાસનની અભૂતપૂર્વ સેવા બજાવવાનો મહાન આર્તિકલાભ પ્રાપ્ત કર્યો છે.

નિત્યાનંદવિજ્ઞય, તેની તે ગંધી ખૂકમાં ને શ્રીસંધના પ્રાણસમા પૂ. બહુશુત ધ્યાનસ્થસ્વર્ગત આગમોદ્ધારક આચાર્ય-પ્રવરશ્રીને પણ અરદીલ ભાષા પ્રોગથી ગાળો લાંડતાં સંકોચાએલ નથી તે તેમના ગુર્વાદિ જ તેવા હેવાનું ધોનીક છે. કારણુક-એરા વિટેડા વિટના ફરજાંદને જ આરડે.

પ્રભુશાસન અને શાસનની અવિનિષ્ઠન પરંપરાનું રક્ષણુ કર્યામાં (આ ગ સન્માર્ગ લોાપકને નીડર પણે અને સપ્રમાણુપણે અવાકુ બનાવો દેવાને સમર્થ એવો) આપનો આ ફણો ત્રિવિધે સુલ્ય છે.

આગમોદ્ધારકશિશુ-કંચનસાગરગણ્ય ભાવનગર  
તા. ૨-૧૧-૬૭

,નવામતિના વિવેકદર્શનનું-પ્રદર્શન' અંગે અક્ષિગ્રામો।

૧- આપે મોકલાવેલ વિવેકદર્શનનું-પ્રદર્શનની એક ખૂક મળી. ધ્યાન્યવાદ.

(આ. શ્રી) વિજયસભુક્ષુરિ દિલહ્સી તા. ૧૩-૧૦-૬૭

૨- આપશ્રી તરફથી મોકલાવાચેલ પુસ્તિકા મળી. વાંચીને ધારું ધારું જાણવા મહિયું. 'વિવેકદર્શન' પુસ્તિકાનો જવાબ ધારો જ ચોંચ છે. 'વિવેકદર્શન' નામ આપીને અને પરમાત્મા શાંખેશ્વર પાર્વતીનાથ પ્રભુના ભવવર્ણનની સાથે જોડિને લેખકે અનિવેકને જ પ્રગટ કરો છે. ખરેખર જે પુસ્તકને વાંચતા મને લેખક પ્રત્યેનો મારો ખૂલ્લાં આદર હોનો તે પણ નાશ પામ્યો. અને એમ પણ થયું કે- સ્વ. પૂ. પાદ સાગરજી મ. જેવા મહાપુરુષ માટે યદ્રાતદ્રા લખીને શાસનને લેખક શું લાલ કુરી દેવા માગે છે? એર, લેખકને સત્યમાર્ગનું દર્શન થાય, એજ લાવના. ધ્યાનેરા તા. ૧૦-૧૧-૬૭

(આ. શ્રી) વિજયરામસ્સુરિ (બુમ. ડેલાવાંગ)

૩- કોણી મળી. પ્રતિકારની સામે પ્રતિકાર એ લવિધ્યનો ધતિહાસ છે, આ પુસ્તિકા એ વાતની સાક્ષી પૂરે છે.

(આ. શ્રી) સુર્યાલસ્સુરિ શિરોધી તા. ૧૬-૧૦-૬૭

૪- 'વિવેકદર્શનનું' પ્રદર્શનની ખૂક મળી. આપે સચિસ્તરથી સચોટ જવાબ આપ્યો. શાસનહિતની ખાતર સહ્ભાવનાથી લખનારા, જન્મમરણુના ઝેરા કાગી ખુલ જ થશે મેળવે. (ઉપા. શ્રી) ધર્મ વિ. (મહારાજ) ત્રાપ્રજ આસો વ. ૧૧

૫- નવામતિની ગંદીલાખાથી સદંતર જુડા અને સજજનને અછાજતા ગલીચ આક્ષેપોથી ભરેલી 'પ્રસ્તાવના

તિમિર તરણુ' બૂકનો સચોટ જવાખ આપનારી તમારી 'વિવેકદર્શનતું-પ્રદર્શન' નામની બૂક મળી છે. વાંચતાં જૈન-શાસન જ્યવંતુ લાસ્યુ' ! શાસનસેવાની અનોડ ધગશને ભૂરિ ભૂરિ અભિનંદન.

પુ. ઉ. શ્રી ધર્મસાગરજીએનુંપ્રશિષ્ટું

ઉ. શ્રી દર્શનસાગરજી ગણું

અમદાવાદ તા. ૩-૧૧-૬૭

૬- આપની પુસ્તિકા મળી. અલિપ્રાય માટે લખ્યું, તો તે પુસ્તક જ પોતાનું સત્યપણું જણાને છે. આ સમયમાં એની જરૂરીઆત જણાતી હતી, જેથી વાંચી સંતોષ થયો છે. તેમાં લખવા પ્રમાણે સામા પક્ષના વિચારેની એકવાક્યતા થાય તો આજના સમાજ ઉપર સુંદર અસર થઈ શકે. બહારથી 'શ્રી શાખેશ્વર પાર્શ્વનાથ અને વિવેકદર્શન' નામ રાખીને તેમાં નહિ લખવા લાયક બાંજું ધારું લખી નાખીને પુસ્તક અચાદ્ય બનાવ્યું તે જ ખુદ્ધિતું પ્રદર્શન છે.

ઉપાધ્યાય શ્રી પ્રિયંકરચિજયજી-ખોડીબલી-સેનેટેરીયમ  
તા. ૪-૧૧-૬૭

૭- આપના તરફથી 'વિવેકદર્શનતું-પ્રદર્શન' બૂક મળી. 'પ્રસ્તાવનાતિમિરતરણુ'માં લખેલ બીનાઓની સત્યમંશોધન દર્શિએ કરેલી સમીક્ષા, તે આ પુસ્તકની નોંધપાત્ર બાના છે. ઉપા. શ્રી જ્યંતવિજયજી (દેલાવાગા) પાલેજ આસો શુદ્ધ ૧૦

૮- આપે મોકલાવેત- 'વિવેકદર્શનતું-પ્રદર્શન' ત્રથા 'પ્રસ્તાવનાતિમિરબાસકર' બંને બૂકો વાંચવાથી એ તિથિવાગાના

મેં પાલીતાણું નજરોનજર નિહાળયું છે કે-તેમનામાં માર્ગાનુસારીપણું પણ નથી. મને જુકું બોલવાની અને જુકું દાખી હેવાની ફરજ પાડનાર જંબૂવિજયજીમાં કુન્યવી પ્રમાણિકતા પણ ક્યાં રહી? માર્ગાનુસારીનો પહેલો શુણું તો પ્રમાણિકતા જ છે. જેમ ગૃહસ્થપણુંમાં પ્રમાણિકપણે રોટલો. રળવો તેમ સાધુતામાં પ્રમાણિકપણે સાધુજીવન ગાળવું એ બન્ને સરખું છે. જે તેમને તો પાળવું નથી જ. જ્યારે તેવી ઝાટી રીતે ભીજને ઉતારી પાડવાનો ધંધો લઈ બેસીને શ્રાવકોમાં પોતાના ઊંચા સાધુ-પણુંની પોતે તેવી ઝાટી રીતે છાપ પાડતા હોય એમ બતાય ત્યારે સુશરૂનોથી તેઓ ફેંકાઈ જાય તેમાં નવાઈ શું?

ટાઇટલ પેજ ઉની વિનાંતિ ઘણુંજ યથાથ્ છે; ૫૨ંતુ પેજ જમાં ‘હાથ જોડિને વિનાંતિ છીએ’ એ લખાણું મને પસંદ પડ્યું નથી. તેઓ શું અગણુંમાં આ બધું કરે છે? અને શું તમે હાથ જોડો એટલે એ કારેલાં મીડા બનશો? હા કારેલાં તો કદાચ ગોળ નાખવાથી મીડા પણ બને, પણ કડવી તુંખડી મીડી ન બને. એને તો પરઠવવીજ પડે. છતાંપણું સંઘની શાંતિ માટે—‘નવો વર્ગ એમ કરતાંય જો આનું કરે તો ઢીક’ એ દૃષ્ટિએ લખ્યું હોય તો વાત જુદી.

એને મીડા બનાવવાની રીત એ જ છે કે-શ્રાવકસમાજ તેમને ફરજ પાડે। બાકી એમને પશ્ચિતાપ થાય અને એ સુધરી જાય એવું મને તો લાગતું જ નથી. છતાં આપ શાસનકંટકેાઙ્ગારક હોવાથી ભલે થઈ શકે તો કંદાનો

ઉદ્ઘાર કરો, મને કશો વાયો નથી; પણ આ કાંટો ગોરડનો છે, ખાવળનો નથી એમ ભારો અનુભવ કહે છે. એટલે આપે તેને પણ સુધારવો જ ધારોં હોય તો એ માટે પ્રથમ તો આપે એ કાંટાની અણુને તેમના હજુ અનેક પકડના બાકી રહેતાં જોરદાર જુડાલ્યુંડ્રપ પત્થરથી ધસી જ નાખવી પડ્યો: આમાં હ્યા કરશો તો ધારું ઇલ જેસવામાં મને તો શંકા જ રહે છે.

અત્યારે તો આટલેથી જ અટકું છું. લાંખા લખાણુના કારણે જે આપને કાંઈ તકદીએ પડે તો અત્યારે જ ક્ષમા માણી લઉં છું.

દી.

આપની ચરણરજ  
કાન્તિલાલ પીમચંદ શાહના  
૧૦૦૮ વાર વંદણા અવધારશોળ.

**નોંધાયે:**— ઉપરના પત્રમાં વાચ્યક મહાશયોને નવામતીઓનું આંતરિક સ્વર્દ્રપ યથાતથ્ય છતાં ય તે પત્રના લેખક શ્રાવક ક્ષાન્તિલાલભાઈ, પોતાના જાત અનુભવ પુરતું જ જણાવી શકેલ હોઈને સુરજનોએ, તેઓનું આંતરિક સ્વર્દ્રપ તે કરતાં તો કેઈ શુણું વધુ કથાંકર હોવાનું માનવું રહે છે.

હં...સ...સા...ગ...ર

૧૧- આપે મોકલાવેલ પુસ્તિકા મળી છે. સાંગેપાંગ લક્ષથી વાંચી છે. શ્રી દેવસૂરતપાગચ્છસામાચારી ઉચ્છેદક નવામતિના નિંઘ, અરલીલ અને નિર્મૂલપ્રાયઃ પ્રચાર સામે આપશ્રીનો અન્યથી અશક્ય એવો સાધાર અને પ્રૌઢ દલીલોથી ધડાએલો એવો સચોટ પ્રયાસ અતિપ્રશંસનીય છે. શાસનદેવ આવા અતિઆવશ્યક શાસન સંરક્ષણનું ત્રિવિધ અનુમોદનીય કાર્યમાં એ હાથે સહાય કરતા હોય તો ચાર હાથે સહાય કરે, એ જ શુલેચ્છા.

### પ્રથોધસાગરજી ગાણી-સુરત આસો વદ ૧

૧૨- આપની 'વિવેકદર્શનનું પ્રદર્શન'ની પુસ્તિકા મળી. વચ્ચી રોમાંચિત થયો છું. શાસનરક્ષણનું આવું કાર્ય આપશ્રી સિવાય કોણુ કરે? આવી જુની જુની વાતો કોણુ જાણી શકે અને આવી સર્વાધ્ય લાખામાં ગોઠવીને કોણુ રજુ કરી શકે? એ તો આપ એક જ. આપનું કાર્ય ખરેખર સર્વ કોઈને પ્રશંસનીય છે.

### ત્રૈલોક્યસાગરજી ગાણી-વેજલાપુર આ. શુ. ૧૦

૧૩- આપકા- 'નવામતિના વિવેકદર્શનનું પ્રદર્શન' સંશક ઐતિહાસિક પુસ્તક મીલા. સાધાંત પદને કે બાદ મુજે તો પ્રભુશાસનકા અંતપર્યાત ઉપયોગી ઐસા મહાન થંથ લગા! યહ પુસ્તક, શ્રી જિનશાસનકે અનુરાગી લોગોકો શાસનકી સત્ય ખાતાં સમજનેકે લાયે અતીવ ઉપયોગી હૈ, ઔર ખણેત વિષયોંકા તલસ્પર્શી અનુભવકા સાક્ષાત્કાર સ્વરૂપ હૈ. પ્રભુશાસનકો કર્વિતભાતોંસે વારંવાર ડંખ દેનેવાંદે વીંછુઆ,

યહ પુસ્તક પઢનેકે બાદ અપના ગર્ભજપનેકા કૃતિમ દર્શાવ કરને મેં શરમીંદ બના રહેગા, એસા મુજકો લગતા હૈ. શાસનદેવ ઉનકો સદ્ધ્યુદ્ધિ દેવે ફી-જૈસે યહ પુસ્તક પઢકર સચ વસ્તુઓંકા સ્વીકાર કરે.

**શાંતિસાગરજી ગણી-ખડોઈ (મધ્ય પ્રદેશ) તા. ૧-૧૧-૬૭**

૧૪-આપે મોકલાવેજ 'વિવેકદર્શનનું-પ્રદર્શન' ખૂબ મળ્ણા છે. વાચી ધણો જ સંતોષ ધરો છે. નવામતીઓનાં મૂળીયાં મુળામાંથી જ ઉંખડી જાય તેનું સચોટ અને મુહાસરનું લખાણુ કરવા દ્વારા નવામતીઓની કપટળળને આપે લારે ખામોશ અને ખંતથી છતી કરી બતાવ્યા છે. શાસનપ્રેમીઓનાં ધર્મપ્રિય હૃદયોનાં હેતને ઉછાળનારા આ વધુ નોંધપાત્ર અને ત્રિકરણુંનો અનુમોદ કાર્યથી આપશ્રોચે ખરેખર શ્રી દેવસૂર તપાગચ્છની અવિચિન્જ સામાચારીના રક્ષણનું ટોચનું કાર્ય કર્યું છે. શાસનનાં સંરક્ષણ અંગેનાં આપશ્રીનાં તમામ પ્રયત્નો ઝૂખ જ ધૂન્યવાદને પાત્ર છે.

મને લાગે છે કે- 'પોતાના બોલ, માન અને સ્થાનને સાચવવા મારે વધોંથી શાસનહિતને હણ્ણીને પ્રવર્તન નવામતીઓને આ પુસ્તક વાચીને દિગ્ભરાં કાંઈક પણ આરાધક-ભાવ હરો તો પોતાનાં હુદ્દુત્યો બદલ પશ્ચાત્તાપ થશે.'

**દિ.- રૈતસાગરજી ગણી-ધૂલીયા તા. ૧૩-૧૦-૬૭**

૧૫-આપ પૂજ્યશ્રી તરક્ષથી પુસ્તિકા મળી છે. શ્રી. ૧૯૮૨થી શાસનની સૂતક-બ્રહ્મ-અસજ્જાય-ખારપર્વી વગેરે

સંખ્યેની શાસ્ત્રીય આચરણાઓને જુથના ખળે જોગી રીતે ખોટી લેખાવવાની વધેંથી ધૃષ્ટતા દાખવી રહેલા નવાપંથીઓને આ પુસ્તકમાં આપશ્રીએ વાસ્તવિક સ્વરૂપે ખુલ્લા કરીને તેઓની વાતોને મુદ્દાવાર સચોટપણે જુડી લેખાવી બતાવી જોઈની અપરંપાર આનંદ થયો છે. આપશ્રી વયોવૃદ્ધપણામાં પણ આ રીતે સંયમહેઠનાથ લોગે શાસનસેવા બજાવો છે ! તેની ભૂરિ ભૂરિ અનુમોદના.

**લિ. વિમલસાગરજી ગણી-લુણાવાડા તા. ૧૩-૧૦-૬૭**

૧૬-આપશ્રીજી તરફથી પુસ્તક મળ્યું. બરોઅર વાંચ્યું. જેમ નવાતિથિપંથીઓએ સં. ૧૯૬૨ સુધી શ્રી દેવસૂર સામાચારી મુજબ આરાધનાની ખારે ય તિથિ તેનાં ભીંતીયાં જૈન પંચાંગમાં અખંડપણે છાપવા પૂર્વક જેઓએ ખારે ય પર્વતિથિનું આરાધન કર્યું હોવાની વાત જગપ્રસિદ્ધ છે, તેમ સં. ૧૯૬૨ના શ્રાવણ માસથી તેઓએ પોતાની તે આચરણાથી ઉલદું જ જોલવા-લખવા અને પ્રચારવા મંડી પડીને તે બારે પર્વતિથિને ૧૧ અને ૧૩ તિથિનું સ્વચ્છ દર્શાવ્યે જ કૃત્રિમરૂપ આપીને શ્રી દેવસૂરસામાચારીનું છડેચોક લક્ષણ પણ તેઓએ જ કરેલ હોવાની વાત જગપ્રસિદ્ધ છે : આમ છતાં તેઓના સંતાનીયાઓએ તેની તિમિરતરણ્ય બૂકમાં નિયાનંદ વિ.ના હાથે આજે -તે શ્રી દેવસૂરસામાચારીનું સંવત ૧૯૬૩ થા અધ્યાપિપર્યાંત પ્રાણુસટોસટ સંરક્ષણ કરનાર ૫. પુ. આ. મ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. જેવા નામી આગમધર મહાપુરુષને

મબાલીની જેમ સામેથી ગળે પડીને ‘શ્રી હેવસુરસામાચારી ભક્તક’ લેખાવવાની અને સં. ૨૦૧૮ ના ખંલાત ચોનાસા સુધી તો જેઓશ્રીની પ્રાય: સર્વત્ર સન્મુખ હાજરીના પ્રતાપે સર્વત્ર ગુપ્તચૂપપણે નાસતા-ભાગતા રહેવાની નિર્માલ્યતા કૈન જગતને પોતે પ્રત્યક્ષકરાવવી પડી છે, તેવા અને તેઓએ જાતે ‘સત્યપ્રિય’ તરીકે અનુભવેલા આપશ્રીને ‘ઝુડાઓદા’ લેખાવવાની ખાલીશતા દાખલેલ છે ! તે જોતાં તેઓ હવે ઘણી ઘણીવાર ઐટા પડવાને લીધે ચઢેલા અનંતાનુભંધી કોધના રોમેરોમે પ્રસરેલ નથામાં ધે-ધૂર દિવાના બની ગયા જણાય છે. આપશ્રીએ આ પુસ્તકમાં તેઓની તે બૂકમાંના એકેએક ગલીય લખાણુંનો વીણું-વીણુંને તેઓનો નથો ઉત્તરી જાય તેવા દાખલા-દ્વારોપૂર્વક સચોટ જવાબ આપ્યો છે ! શાસનદેવ આપશ્રીના આવા લગીરથ પ્રયત્નમાં સહાય કરે.

**લિ. (હમાંશુસાગર ગણ્ણી-સુરત આંસો વદ ૧ શુળ્ક**

**૧૭- ‘વિવેકદર્શનનું-પ્રદર્શન’ પુસ્તિકા ભગી.** વાંચતાં વાંચતાં આપશ્રીની શાસન પરતેની નિર્દર-નિઃસંકોચ-તત્ત્વસર્વરીં અંત અંતરંગી વફાદારીના મધુર દર્શન થતાં પાને પાને પુસ્તકિત બની જવાયું ! પુસ્તકમાં શાસનાક્ષ પરતેના દિવોનનીભર્યાં વાતદાર્યથી સામાપ્ક્ષને શાખીય ચુક્તિયુક્ત રીતે અને નવી જ જાણુંના મળેલી પુખ્ત દ્વારોથી અપાએલા સચોટ જવાઓએ આર્દ્ધર્થમુંગધ બનાવ્યો ! જવાઓ ઘણ્ણા ઘણ્ણા પ્રેરક અને પ્રધાનનીય છે. જે પુસ્તકની જરૂર હતી તે આપે બરાબર

સમયે જ પૂરી રહેલ છે, તે બદલ શાસનપક્ષે ગૌરવ લેવા જેબું છે.

નૂતનપક્ષ, નિજની અભિજ્ઞતા સ્થાપવા માટે શાસનપક્ષને હલકો ચીતરી શ્રીસંઘમાં જે કૂટરીતિથી પ્રોપેગેન્ડા ચલાવી રહેલ છે, તે પ્રોપેગેન્ડાની વિષમતાને ઓળખાંખી લેવા સારું શાસનપક્ષને આ પુસ્તિકા ધણી જ ઉપયોગી પૂરવાર થશે. ‘પોતાનો પક્ષ ધણો ત્યાગી છે અને શાસનપક્ષ સાચ શીથિત છે’ એમ ખતાવવા માટે તે પક્ષ, પોતાના પ્રચારમાં જે હાંબિક નીતિ-રીતિઓ અપનાવી રહેલ છે, તે જૈનમુનિની શાસ્કોક્ત નીતિ-રીતિથી વિપરીત હોઈને ભવાંતરમાં તે પક્ષને દુઃખદ્વારાયક નીવડવાની જાણી દુઃખ થાય છે.

આ પુસ્તિકાનું સમસ્ત લખાણું તે પક્ષને પણ ઉદ્ધરવા હુથ લંખાવે છે, તે આપશ્રીનો તે પક્ષ પરત્વે પણ સમભાવ હોવાનું સૂચયે છે. નૂતનપક્ષ તરફથી શાસનપક્ષ સામે ત્રીશોક વર્ષથી ચાલી રહેલાં આવાં હાંબિક અને પ્રચંડ પણ આડમણોનો આ રીતે આજ સુધી ધણો ખમીરથી આવા સજજડ અને અજેય સામના દર્શાંક અનેક પુસ્તકો આપે જૈનસમાજને ચરણે ધરેલ છે તેમાં પણ આ પુસ્તક શેખર છે.

**લિ. મુનિશ્રી યરોલદ્વિજય (ઉલાવાળા)**

વીરમગામ તા. ૧૪-૧૧-૬૭

**૧૮-** આપકે દ્વારા પ્રેરિત-‘પ્રસ્તાવના તિમિરભાસ્કર’ તથા ‘વિવેકદર્શનનું-પ્રદર્શન’ દ્વારાંદી મૈને પઢી. નિષ્પૃષ્ટતયા

વસ્તુતથીકો જિસ દંગમે આપને પ્રસ્તુત કર્યા હૈ વહુ પ્રશાંસનીય હૈ. ધૂન દોનો પુસ્તકોમેં મુજે આપકી તાકિંકર્શાંકી અણુત અંગી લગી. શાસનહેવસે યહી પ્રાર્થના હૈકિ-આપકો ખર્મ વ શાસનરક્ષાકે કાર્યમેં હુંમેશાં મહદ દેતા રહે.

લિ. પદ્મસાગર પંક્જ-સાણું હ તા. ૨૫-૧૦-૬૭

૧૯- આપની 'વિનેકદર્શનનું-પ્રદર્શન' ખૂક મળી, વાંચી-ખીજોને પણ વંચાવી છે. સામા પક્ષને પોતાની અસત્ય-વાતોને થૈન્કેન નીભાવવા સારુ સંધમાં વારે વારે કલેશકારી ચીનગારીઓ મૂક્યા કરવો અને ખીજ સૌ દષ્ટા બની રહે, એવી કપરી સ્થિતિમાં આપને અથાગ પરિશ્રમ લઈ એકલા હાથે જ એવાવની ! જે ધણું જ મુશ્કેલ કાર્ય છે.

આગામ પાછદનું મજબુત સાહિત્ય એકદું કરી આવો સચોટ અને ભણુભણુતો જવાબ આપવામાં ચાલુ મુનિગણુમાં કોઈપણ જણાતું નથી : આ સ્થિતિ હોવા છતાં આપે પ્રભુશાસનની સત્ય ભીનાઓનું-સામાપક્ષની કવમ ખૂંઢી કરી દેવા પૂર્વક-રક્ષણુ કરવામાં આવો તેજસ્વી પ્રયાસ વખેઠી જારી રાખીને જે શાસનસેવા બજાવી છે તે આપનું લુચન આપે પ્રભુશાસનને સમર્પિત જ કરી દીધું હોબાનું પ્રતીક છે.

કાત્યોપાસક મુસુકુ-સુરત તા. ૨૪-૧૦-૬૭

૨૦- આપની 'વિનેકદર્શનનું-પ્રદર્શન' પુસ્તિકા મળી. મેં ભાવંત મનનપૂર્વક વાંચી. પુસ્તિકામાં આપે મુદ્રા બરાબર

રજુ કર્યા છે. તથા સમાલોચના પણ શાસ્ત્રાનુસારી અને ધર્માનું હર કરી છે. શાસ્ત્રવિરુદ્ધ પ્રદ્રપણા કરનારાઓને સાચા શાસ્ત્રીય અથ્રો બતાવવાપૂર્વક હું મેશને માટે ખોલતા બંધ કરી દેવાનું અમીરવાળું સત્ય ખડું કરીને આપશ્રીએ અનેક ભવ્યાત્માઓને ખોટા અથ્રો તરફ દોરવાઈ જતા ખ્યાંયા છે.

આપની યાદશક્તિ-શબ્દરૂપી-વચનશૈલી અને વાક્યરૂપી આશ્ર્યચક્તિ બનાવે છે. માર્ગ ચૂકેલાઓને ભૂતકાલીન શાસ્ત્રવિરુદ્ધ વાતો પણ બતાવીને શ્રીજૈનશાસનની જ્યોતને તાજગી આપી છે ! આપની શાસનસમર્પિત સત્યનિષ્ઠાપૂર્વકની શાસનની ધગશ અનહૃદ પ્રશંસાપાત્ર છે. માનું છું કે-આવા સુશવિક્રાનોથી જ જૈનશાસન જ્યવંતુ વર્તો છે.

શાસનરસિક દરેક સુશજ્ઞનોએ, આ પુસ્તિકા અવશ્ય વસાવવા ચોગ્ય છે. કારણ કે-તેને મધ્યસ્થપણે શાંતાચેતો આધિત્ત મનનપૂર્વક વાંચવાથી કુમતનો આથડ છૂટી જવા પામે તેમ છે.

**૫. પોપટલાલ જેડાલાલ વોરા-વીરમગામ તા. ૧૪-૧૧-૬૭**

૨૧-આપના તરફથી મુનિ નિત્યાનંદવિજયજીને લખેલ પુસ્તિકાના જવાખરૂપે પુસ્તિકા ખડાર પડી તે વાંચી. ઉંમર અને આંખની તકલીફ બિગેરે કારણોસર જે હથીઆરો છોડી દીધાં, પણ આપને જ્યારે ખીલકુલ અણુધટતું-અણુછાજતું-કોલકલિપત અને અજ્ઞાનમૂલક લખાણ લખાય છતાં બધા મૌન રહે ત્યારે કેમ ચેન પડે ? સિંહ, વૃદ્ધ હોય-થાકેલ હોય છતાં કેસરાને કેમ એંચવા હે ?

પુસ્તિકા પુરી સાધંત તો વાંચી નથો; પરંતુ એટલું ચોક્કસ કહેવાય કે-તેમાં તમે ભવલીરીતા રાખી જે વસ્તુ કહેવી પડે તે જરાપણું સંકોચ રાખ્યા સિવાય બહાદુરીથી હી છે. શ્રી વિજયવલ્લભસુરિલું મ.નું જ્યાં ચોગ્ય લાગ્યું અને ખરે જ પ્રશાંસાસ્પદ વાત હતી ત્યાં તેની પ્રશાંસા કરી છે અને જે વસ્તુ બરાબર નથી તેને તે રીતે રન્નું કરી છે.

એ જ પ્રમાણે આ. વિજયદાનસુરિલું માટે કે રામચંદ્ર-સુરિ માટે જ્યાં કહેવા ચોગ્ય કહ્યા છતાં તેમના જે ગુણો લાગ્યા તેની મુક્તાકંઈ પ્રશાંસા કરવાનું પણ ચૂક્યા નથી ! આ ઓછી સમતોલતા નથી. શ્રી દાનસુરિલું માટે કહેવા ચોગ્ય કહેવા છતાં તેમના ચારિત્રની પ્રશાંસા કરવાનું ચૂક્યા નથી. અને રામચંદ્રસુરિલું સાથે આગલો આટલો તિથિ અંગે મતસેદ હાવા છતાં તેમની વક્તૃત્વશક્તિની પ્રશાંસા ભારોભાર કરવાનું ચૂક્યા નથી !

આમ એકંદરે પુસ્તકમાં આપે આપનું લગ્બાણું ખૂલું જ સમતોલતા રાખીને અને જે વસ્તુ જે રીતે હોય તેને તે રીતે રજૂ કરો છ. કોઈપણ જાતના આવેગમાં તથ્યાયા વિના વસ્તુને થથાતથ્ય રજુ કરી છે.

પંડિત મહેતલાલ અવેરચંદ્ર-અમદાવાદ તા. ૨૫.૧૦.૬૭

૨૨-સમાલોચના-નવામતિના ‘વિવેકદર્શનનું પ્રદર્શન’ અને પ્રસ્તાવના ‘તિમિરતરણિની અસારતા’ દેખક શાસન-સંરક્ષક પૂજ્ય પાઠકપ્રવર શ્રી હંસસાગરલું ગણ્યિવર, મહાશક

અને પ્રાપ્તિસ્થાન શા. મેતીયંદ હીયંદ મુ. ડળીયા-વાયા  
તળાણ, કિ. ઝા. ૧-૦-૦.

નવા વર્ગો ચાલુ વર્ષે “શ્રી શાંખેશ્વર પાઠ્રનાથ અને  
વિવેકદર્શન” નામની ખૂક પ્રસિદ્ધ કરીને તેખૂકમાં “પ્રસ્તાવના  
તિમિરતરણી” નામની સ્વમંત્રયોજક જેરી વાતો ભરેલી ખૂક  
ધૂસાડી દેવાનો વિવેક દર્શાવેલ છે, તે વિવેકદર્શનનું આ ખૂક  
દ્વારા સમ્પ્રમાણુ પ્રદર્શન કરાવવામાં આવેલ છે. વાયક મહાશયોને  
વિજાપ્તિ કે-આ ઐતિહાસિક ચુસ્તિકાને ખારીકાઈથી તલસ્પર્શી-  
ધણે વાંચે અને વિચારે.

**શ્રી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર**  
તા. ૧૦-૧૧-૬૭ નો. અંક ૧-૨

૨૩-‘વિવેકદર્શનનું’ પ્રદર્શન અને પ્રસ્તાવના તિમિર-  
તરણીની અસારતા’ ખૂક સાલાર સ્વીકારેલ છે. આપે જૈન-  
શાસનની ખડે પગે ચોડી રાખી છે, તે જાણી આનંદ  
થાય છે. આપ શાસનમાં અથડાતા કાંટા-જળાને એકદે હાથે  
દૂર કરી રહ્યા છો તે વારસો કોઈ સંભાળે તે માટે આપનું  
ધ્યાન ખેંચવાનું મન થઈ આવે છે.

આપે પુસ્તકમાં જે જીણુવટખરી જહેમત ઉઠાવેલ છે તે  
માટે હૃદયપૂર્વક આલાર.      લિ. અલેયંદ્રા અનેક વંદન

**શ્રી ધરોવિજય જૈન અંધમાલા ભાવનગર**  
તા. ૨૬-૧૦-૬૭

## અભયદેવસૂરિના વારસદાર ગણ્યાવવાનો પેંટરો ?

આગમધરદેષી મહામૃપાવાદી નિત્યાનંદવિજયે ભાવનગરના તા. ૧૦-૧૧-૬૭ના 'જૈનધર્મ-પ્રકાશ' ના પાના ૬૩૩૧૨ ઉપર શ્રી અભયદેવસૂરિજીનો જીવનવૃત્તાંતદર્શક લેખ છ્યપાવેલ છે. તે લેખ, તેમણે—“સં. ૧૯૬૬માં પૂ. પ. શ્રી કલ્યાણવિ. મહારાજે પ્રસિદ્ધ કરેલ ‘શ્રી ધર્મ-સાગરીય તપાગચ્છપદ્માવદી સાર્થ’ ના પેજ ૧૨૧ થી ૧૨૨ ઉપર ‘નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિ’ શીર્ષકતળે છ્યપાવેલ તેઓશ્રીના જીવન-વૃત્તાંતને આધારે” એમ જણાવવાનું છ્યપાવીને તેમજ તે વૃત્તાંતને મનસ્વીપણે ઘરાની-વધારીને તથા મૂળભાષાને નિજના ટાયલાવડે વિકૃત ખનાવીને રજુ કરેલ છે. તે લેખ લખતી વખતે તેમણે તે ‘પદ્માવતી સાર્થ’ ના પાના ૧૧૭ ઉપરની ટીકામાં તેમજ પાના ૧૨૩ ઉપરના શ્રી જિનવલલભસૂરિના વૃત્તાંતમાં તે શ્રી અભયદેવસૂરિજી મ. ના શુરૂ શ્રી જિનેશ્વરસૂરિજી મ. ને કૂર્ચ્છા-પૂરગચ્છીય જણાવ્યા હોવાનું જાણ્યું જ હોય અને તે ઉપરથી તે લેખકે, ‘તેઓશ્રીના શિષ્ય તે શ્રી અભયદેવસૂરિજી મ., વિજ્ઞયગચ્છીય નહિ; પરંતુ કૂર્ચ્છા-પૂરગચ્છીય હતા’ એમ પણ બાણી લીધું જ હોય.

આમ છ્ટાં તે જૂડમૂર્ત્તિં નિત્યાનંદવિજયે ‘જૈનધર્મ-પ્રકાશ’ માંના તે લેખના શીર્ષકમાં તે પૂ. શ્રી અભયદેવસૂરિજી મ. ને ‘વિજ્ઞયઅભયદેવસૂરીશરળ મ.’ એ પ્રકારે ઓળખાવીને લગભગ ૬૦૦ વર્ષું બાદ તેઓશ્રીને વિજ્ઞયગચ્છીય

લેખાવવાનું એક વધુ જુઠાણું ઉલું કરવાની પહેલ કરી છે !

તેમનું આ વર્ત્તન અને આ સાહુસ જોતાં એમ માનવું થાય છે કે—“સં. ૧૧૨૦માં ઢાણુંગવૃત્તિ રચનાર તે શ્રી અભયદેવસુરિલુ મ. ને જેમ સં. ૧૩૦૪માં નીકળેલ ખરતરે, પોતાને તેઓશ્રીના વારસદાર લેખાવવા સાર્થક-ખરતરીય લેખાવવાનું કૌલાંડ ઉલું કરેલ, તેમ સં. ૧૬૬૨માં નીકળેલ નવાતિથિમતીઓએ પણ હવે વખત જતાં-આવા જુદ્ધા લેખકોના હાથે-પોતાને તેઓશ્રીના વારસદાર લેખાવવા સાર્થક-તે પૂ. અભયદેવસુરિલુ મહારાજને પોતાની માન્યતાવાળા લેખાવવાનું કૌલાંડ ઉલું કરવા ધારેલ હોવાનો આ પ્રથમ પેંતરો હોય. જૈનસમાજે આવું માનસ ધરાવતા જુદ્ધા લેખકોથી સાવધ રહેવની જૂબ જ જરૂર છે.

તેઓ આચુષ્યને અંતેય અંથિલેહ કરે તો સાર્થક !

તે પ્રકારના ગ્રમાણિક અને શાસ્ત્રપ્રેમી નિત્યાનંદવિજયે તે ‘જૈનધર્મગ્રકાશ’માંના પોતાના તે લેખમાં પાના ૧૨ ઉપરના પહેલા કોલમના ખીળ પેરામાં ‘જ્યારે પ્રથમના એ અંગસૂત્રો શ્રી આચારાંગ અને શ્રી શીદ્વાંકાચાર્ય-મહારાજે રચેલી ટીકા આજે મોઞુદ છે.’ એમ લખ્યું છે ! તે લખાણું પરથી તે નિત્યાનંદવિજય, ટીકાને પણ અંગસૂત્ર ગણુવાનું જ્ઞાન ધરાવવાની હદ સુધીના જ્ઞાની હોવાનું આખાદ રૂપી થઈ જય છે. “આવા શાસ્ત્રઅધ્યુમ્ને આ. શ્રી પ્રેમવિજયલુ તથા તેના ગુરુ જાંબુવિજય, સિદ્ધાંતાની સૂક્ષ્મ

વાતોનેય જેમ ક્ષાવે તેમ બેહુદી ચીતર્યાં કરવાની સ્વર્ચંદ્તાનું મેદાન મોક્ષનું કેમ કરી આપતા હશે ?” એ પ્રશ્નનો ખુલાસો એ છે કે—“પોતાના વડિલ આ. શ્રી દાનસુરિલુએ આગમના સૂક્ષ્મભોધના અભાવે કેટલાક આગમશાસ્ત્રપાડોના પણ ખોટા કરેલા અથેને સૂક્ષ્માર્થદિષ્ટએ ખોટા જણુવનાર પૂ. આગમો-દ્વારક આ. મ. શ્રીને તે તે અર્થમાં ચેન કેનાપિ ખોટા વૈખાવવા સારુ તેઓને શાસ્ત્રીયચર્ચાના મેદાનમાં પડદા પાછળ રહીને તેલા આડે સાંઢીયો ધરવાની જેમ આવા ગાળગાળીથી પણ યદ્વા તદ્વા ફેંકાઈંક કરનારા શાસ્ત્રબૂધુંએ તો પોતાના રક્ષણુની ઢાલદ્વપે કામ આવે છે.”

તેઓના આવા પ્રપંચો આપણું વોકેંતરસમાજના જ્યાદમાં ન આવી જય એ સારુ તેઓ પ્રચારમાં વિઘમાન હજાર ઉપરાંત સાધુઓમાં પણ—પોતાને અને પોતાના સાધુઓને જ વારંવાર શાસ્ત્રપ્રેમી અને સુવિહિતો વૈખાવવાનું જોર દાખ્યો કરે છે તેઓનું તે પ્રચારતાંડવ, ઉપર જણુવેલા પડ્યંત્ર ઉપરના પડદા રૂપ છે. આ પ્રકારના વર્ત્તનવાળા સાધુઓના ચારિત્રને શાસ્ત્રે જ્વલણથી દ્રવ્યચારિત્ર જણુવેલું છે. તેવા ચારિત્રના પણ પ્રતાપે તેઓ ગોશાલાની જેમ આયુધના અંતેય અંથિલેદ કરવા ભાગ્યશાળી બને, એ જ શુલેચ્છા.



આવા જુડા સિવાય જુડનું રક્ષણ કરે પણ કોણ ?

પોતાના જુડા શિષ્ય નિત્યાનંદ વિ. ના હાથે પ્રાસેદ્ધ કરાવેલ તરણિમાં ‘સં. ૧૯૮૮માં સુરતમાં તેલું કાઈ બન્યુ જ નથી’ એમ લખાવનાર જંબુવિજયે, સુરતમાં સં. ૧૯૮૮માં આ બુકમાંનો શ્રીયુત અમીચંદ ગોવિંદજી શાહ એડવોકેટનો તે વખતનો એટકે કે ૩૫ વર્ષ પૂર્વેનો પણ પત્ર ખાલે છે તેટલું જાતે અનુભવેલું હોવા છતાં એ પ્રમાણે હોઘરક જુડું લખાયું છે, તે ઉપરથી તેના જીવનને ‘મુસાવાયાએ વેરમણું’ તો રૂપરથ્યું જ નથી, એમ નિઃશંકનહિ માનવાનું કોઈ કારણ નથી.

તેઓએ તેલું જુહું ખોલવાનું પણ મુખ્યત્વે તો તેમના દાદાશુરુ પૂ. આ. શ્રી દાનસુરિલુએ પોતાને ‘સકલ શાસ્ત્ર પાર દૃષ્ટા’ની પોતે લાદેલી ઉપાધિના ‘અહુ’વશાતું પોતાના ‘વિવિધ-પ્રક્ષોત્તર’ થંથમાં શાસ્ત્રવિરુદ્ધ જે જે ગોળા ગણડાવેલા છે, તે ગપગોળાને ચેનકેનાપિ સાચા લેખાવવા માટે જારી રાખેલ.

તેમના વડે પૂ. આ. શ્રી દાનસુરિલુ મ. શ્રીની શાસ્ત્ર-વિરુદ્ધ વાતોનો ગોખી જુડાખુાઓથી કરાતા અચાવના આ પ્રકારને આ. શ્રી પ્રેમસુરિલુ અને આ. શ્રી રામચંદ્રસુરિલુ વગેરેએ પોતાના પક્ષની વક્ષાદારી માનીને જંબુવિજયદ્વારા કરાતા તે અસત્યના પોષણીય કાર્યમાં જંબુવિજયને થાખડાયે રાખવાનું જ જારી રાખ્યું !

તે ત્યાં સુધી કે—‘પૂ. આ. શ્રી દાનસુરિલુ સં. ૧૯૯૨માં કાળધર્મ’ પામ્યા ત્યાં સુધી પોતાના ‘વિવિધ પ્રક્ષોત્તર લાગ બીજા’માંનો એક પણ પ્રશ્નોત્તર સુધારવાનો પોતાને અવસર

મહ્યો નહિ, એટલે તે પ્રશ્નોત્તર ચંથ, અથથી ઈતિ સર્વાંગ સુધારી વધારી અને ત્યાર કરવાની સંપૂર્ણ સત્તા તે બંને વડિલોએ આ જુઠ વિષ્યાત જંખુવિજ્યને સુપરત કરી !’ પરિષ્યુભ એ આંયું કે— “તે ખીન ભાગમાંના કેટલાયે પ્રશ્નોત્તરોને પુ. આ. શ્રી દાનસુરિલુની વાતથી વિરુદ્ધ જઈને સુધાર્યા છે. અને આ ખૂકમાં ‘અધ્યમાધ્ય’ની જણાવેલી વાત મુજબ અનેક પ્રશ્નોત્તરોની નીચે મનસ્વી ટિપ્પણો કરીને શાસ્ત્રો તથા પરંપરાનો ભયંકર દ્રોહ કર્યો છે.” ‘વિ. પ્ર.’ લા. રનું કાર્ય આવાને જોંપવામાં તેના વડિલોનો એ હેતુ તો ખરો જ કે— ‘એવા જુઠા માણુસ સિવાય તેવાં જુઠાણુંનું રક્ષણ અન્ય કરે પણ કોણું ?’

એવો જ ખીને દ્રોહ, તે જંખુવિજ્યે સં. ૧૯૯૮માં તેમના શિષ્ય ચિદાનંદવિજ્યના નામે પ્રસિદ્ધ કરાવેલ ‘શ્રી હૃદીર પ્રશ્નોત્તરાનુવાદ’ નામની ખૂકમાં કેટલાક શ્રી હૃદીર પ્રશ્નોત્તરના અથો મનસ્વી કરીને અને કેટલાયે ટિપ્પણો, શાસ્ત્ર અને પરંપરાની વિરુદ્ધ કર્યો છે. તે શ્રી હૃદીરપ્રશ્નોત્તર ખૂકમાંની ૭૩ મી નોંધમાં તે જુઠા માણુસે સૂતકને વિષેને ગપગોળાઓ ગણડાંયા છે, તે દરેક ગપગો એનું મૂળ પણ ‘વિવિધ પ્રશ્નોત્તર’ ભાગ હેઠાના પાના ૨૧૦ થી ૨૧૩ સુધીમાં પુ. આ. શ્રી દાનસુરિલુએ સૂતક અંગે શાસ્ત્ર તથા પરંપરા વિરુદ્ધ ગણડાનેવ ગપગોળાઓ છે. અને તે કેવી રીતે ? તે પસ્તુ અમાંના તરફથી ઝડપલેર તૌથાર વઈ રહેવ ‘વિવિધ-પ્રશ્નોત્તર શુદ્ધિપ્રકાશ’માં સુગ્રાવાયકોને થોડા મહિનાએઓપાં જ જેવા માણશે.

માગશર વદ પ ગુરુને વાંકાનેર

## મુનિ નિત્યાનંદવિજયને

નિત્યાનંદવિજયજી ! તમારા શુરૂના થડાવ્યા ચડી જઈને  
તમે તમારી 'પ્રસ્તાવનાતિમિરતરણી'માં જીવતાને મરી ગયેલા  
તરીકે, સાચાને જુઠા તરીકે તેમજ જુઠાને સાચા તરીકે  
જણાવવા ભવની જીતિ રાખ્યા વિના ખુખ કમર કસી !

પણ શાસનના સફ્ટલાઙ્ઘે સાર્ઝ થયું કે-તમે જેમને  
મરી ગયેલ જાહેર કર્યા તે શ્રીયુત્ અમીમંદ ગોવીંદજી શાહ  
એડવેકેટ હજુ જીવંત છે, કે-જેમના પત્રોથી આ ખૂકમાં  
તમારા તે શુરૂ કેવા જાણીમ જુઠાણુના ભંડાર છે ? તે ખુલ્લું  
થઈ જવા પામ્યું છે. આ ખૂક વાંચ્યા પછી હુવે તો-જે  
આત્મસુધારની તેમજ સંયમની પડી હોય તો-તેવા જુઠાઓનો  
સંગ સત્વરે તળ શાસનસંરક્ષકોનું શરણું સ્વીકારશો; કે-જેથી  
લીધેલ વેષની સ્વાર્થીકરા થવા પામે.

આ ખૂકમાં આપેલો તે સં. ૧૯૮૮ ની : ચાની  
રાજેયાંગ ૨૪ : ધિ ૧૨ વાંચ્યા પછી તો તમારે તમારા  
'સાર્ઝ છે કે-મારા શુરૂ હથાત છે' એ વાક્યને—"નહીં"  
તો મને 'એવી કોઈ ખીના બની જ નથી' એમ ધરાર જુહું  
કોણું જણાવત ?" એ પ્રક્ષાર્થી જ પૂર્ણ કરવું રહે છે ને ?  
ખોટાનું પણ ખોટી રીતે જ એંચવા જતાં કેવી દુર્દ્શામાં  
મૂકાયા ? વિચારશો.

## ગુજરાત લેવા જતાં હવેલી ઓધ !

પેશાએ ગુજરાત પણ લેવા જતાં રહેવાની હવેલીય ગુમાવી તેમ પૂ. આ. શ્રી દાનસૂરિજીએ, પૂ. આગમધરત્રીનુંય જવાહીર નિસ્તેજ લેખાવવા જતાં પોતાનું હીણુતેજ જવાહીર પણ ગુમાંયું !

(૧) સં. ૧૯૫૨ થી એક નિથિને ખોટી રીતે તિથિ લેખાવવા જતાં ૧૯૬૨ થી તો બારેય તિથિને ખોટી રીતે તિથિ લેખાવનાર પરિવાર પ્રાપ્ત કર્યો ! અને એ પરિવારે તો બારેય અખંડ તિથિવાળા જૈની પંચાગને વમીને અંહિત તિથિવાળા અજૈની પંચાગને જ જૈની પંચાગ મનાવવાની ઉંવાટે ચડી જૈનરવ જ ગુમાંયું !

(૨) આગમના ઓધ નિના પૂ. આગમધર સામે પોતાનું ‘કૃત્તિજીનાગમપારદ્રષ્ટા’ પણું દેખાડવા માટે કરવા પડેલા અનેક જૂઠા અથેને-આ! બૂકનું લખાણુ જણાવે છે તે રીતે- સાચા લેખાવનારા ઘણું શિષ્યો પેહા કરવાને પરિણામે શુદ્ધ પ્રદ્યપક શિષ્યો જ ગુમાંયા !

(૩) સં. ૧૯૪૬ માં ચંદ્ર વિજય બન્યા પછી પોલીસપટેલ બન્યા અને તે પછી દાનવિજય બન્યા, છતાં દીક્ષાસંવત્ત ૧૯૪૬નો જ ગણ્યાવવાના એક જૂઠ ખીજનું પરિવારમાં તો આજે વૃક્ષ બની જવાથી, હતું ને સત્ય પણ ગુમાંયું !

(૪) અન્યના ખોટી રીતે ‘પદ્ધદર’ તરીકે ગોઠવાએ જવાની મુત્સદીગીરીમાં ગુરુના ય પદ્ધદર લેખાવવાનું ચાનસ ગુમાંયું !

(૫) સંયમ સારં; પરંતુ તેનો અંભમ તે હોવાથી ખરેખર તેઓશ્રીએ તો ગુજરાત લેવા જતાં હવેલીય ગુમાવી ! આ વાતને વિશેપે સુમજવાના જિસાસુઓએ, તૈયાર થઈ રહેલ ‘વિવિધપ્રમોતરશુદ્ધિપ્રકાશ’ અંથ વાંચવા તૈયાર રહેલું.

## વિવિધપ્રક્ષોત્તર - શુદ્ધિપ્રકાશ

જૈન તેમજ સેવા સમાજ પત્રમાંની જહેરાત મુજબ  
'વિવિધપ્રક્ષોત્તર-શુદ્ધિ પ્રકાશ' નામનું મિથ્યાપ્રકૃપણા-  
એની મજબૂત અને સર્વાંગ સપ્રમાણુ શુદ્ધિ દર્શક પુસ્તક  
અડપલેર તૈયાર થઈ રહ્યું છે.

નવા તિથિમતિઓએ જેઓના નામે શ્રીસંઘની સૂતક  
અને થહુણી અસજાય વર્જવાની શાસ્ત્રસિદ્ધ અવિચિન્ન  
આચરણને તેમજ બારપરીની આરાધન.ને ઉથલાવી  
નાખવાનું ઘાર અપકૃત્ય કરવા અદ્યાપિર્યાન્ત જેઓને  
'પરમ પુરુષ-પરમતારક-પરમશુર-પરમબીજિનાગમ પારદ્ધ્યા  
વળે શ્રી જિનેશ્વર ભગવંતો ચિત વિશેષણોથી નવાજવાનું  
અને જેઓના વિવિધપ્રક્ષોત્તર અંથેમાંના ઉત્તરોને ગણધર  
ભગવંતના ઉત્તરો જેવા ગણ્યાવવાનું પાખંડ ચલાવેલ છે, તે  
તેમના ભૂતકાલીન પોલીસપ્ટેલ દાદાશુર પૂ. શ્રીદાનસૂરિજીએ  
પોતાના તે 'વિવિધ પ્રક્ષોત્તર' ભાગ બેમાંના ઉત્તરોમાં  
‘સકલશાખપારદ્ધ્યા’ પણ્ણાનાં ‘અહ’માં પોતાની સજાનતા  
ઓવાઈ જવાથી જે ‘સો’ ઉપરાંત સ્થલે શાસ્ત્રવિદ્ધ ખાલેલ  
છે, તે દરેક અશુદ્ધિની એ પુસ્તકમાં શુદ્ધિ કરવામાં આવેલ  
છે. કલ્યાણકામીજનો વાંચવા તૈયાર રહેણો થોડા મહિનાઓમાં  
જ સંપૂર્ણ તૈયાર કરી પ્રસિદ્ધ કરવા ઉમેદ છે.

**મુદ્રક :** શ્રી નવજીવન પ્રાન્ટસ, દીવાનપરા, મુા. રાજકોટ.

